

Super Visa/ Visitor to Canada Insurance



- Best Mortgage Rates
- 1st and 2nd Mortgages
- Life and Critical Illness Insurance
- RRSP/RESP/INVESTMENTS

Ph.: 416-839-9645

Mukund Sheth
Financial Advisor
www.pyramidfinancial.ca
mukund@pyramidfinancial.ca

Serving at 2 locations
GTA East / GTA West
Investment | Insurance | Mortgages

સ્વદેશ

પરદેશમાં દેશની મહેક એટલે

કેનેડાથી પ્રસિદ્ધ થતું સર્વોત્તમ ગુજરાતી સાપ્તાહિક SWADESH



FRIDAY, 04 JUNE, 2021 Vol. 18, No. 23 Pages 20 Tel: 416-996-7755, E-mail : info@swadesh.news Web : www.swadesh.news

લેબર સંગઠનનો અહેવાલ

કોરોનાને કારણે દુનિયામાં 20.5 કરોડ બેરોજગારો પેદા થશે: UN

રોજગારી અને રાષ્ટ્રીય આવકની બાબતમાં બધા દેશોનો રેકોર્ડ દોઢ વર્ષમાં કથળ્યો: હાલમાં 10 કરોડથી વધુ લોકો બેરોજગાર

વોશિંગ્ટન

સંયુક્ત રાષ્ટ્રસંઘ સંલગ્ન ઈન્ટરનેશનલ લેબર ઓર્ગનાઈઝેશનના અહેવાલમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી કે મહામારીના કારણે દુનિયામાં બેરોજગારીનું મોટું સંકટ સર્જાશે. ૨૦૨૩ સુધીમાં ૨૦.૫ કરોડ નવા બેરોજગારો પેદા થાય તેવી દહેશત વ્યક્ત થઈ હતી. ઈન્ટરનેશનલ લેબર ઓર્ગનાઈઝેશનના ચિંતાજનક અહેવાલમાં કહેવાયું હતું કે રોજગારી અને રાષ્ટ્રીય આવકની બાબતમાં બધા જ દેશોનો રેકોર્ડ દોઢ વર્ષમાં અતિશય કથળી ગયો છે. આવો જ ટ્રેન્ડ રહેશે તો બધા જ દેશોમાં બેરોજગારીનું સંકટ વિકરાળ બની જશે.

આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠનના ટ્વિટર એકાઉન્ટમાંથી એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો, જેમાં વિવિધ આંકડા રજૂ કરીને બેરોજગારીની સમસ્યા દર્શાવવામાં આવી હતી. અહેવાલ પ્રમાણે ૨૦૨૩ સુધીમાં દુનિયામાં ૨૦.૫ કરોડ લોકો બેરોજગાર બની જશે. અત્યારે જ દુનિયામાં ૧૦ કરોડ કરતાં વધુ લોકો બેરોજગારીનો સામનો કરી રહ્યા છે.

વર્લ્ડ એમ્પ્લોઈમેન્ટ એન્ડ સોશિયલ આઉટલુક : ટ્રેન્ડ્સ ૨૦૨૧ રીપોર્ટમાં કહેવાયું હતું કે જો મહામારી ટ્રાટકી ન હોત તો દુનિયામાં ૨૦૨૦-૨૧ના વર્ષમાં ૩૦ કરોડ જેટલાં લોકો માટે નવી રોજગારીની તકો સર્જવાની હતી. કોરોના મહામારીએ દુનિયામાં હાહાકાર મચાવ્યો તેના કારણે ૩૦ કરોડ રોજગારી સર્જવાને બદલે ૧૦ કરોડ બેરોજગારો પેદા થયા હતા. યુએનની એજન્સીએ કહ્યું હતું કે મહામારીની અસર આ આખા દશકા પર પડશે. ૨૦૨૦માં કુલ કામકાજના સમયમાં ૮.૮ ટકાનો ઘટાડો થયો હતો. એટલે કે ૨૫.૫ કરોડ લોકો એક વર્ષ સુધી કામ કરે એટલી કલાકો વેડફાઈ ગઈ છે. એ ખોટની ભરપાઈ થતાં વર્ષો નીકળી જશે.

અહેવાલમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી કે



મહામારીના કારણે અસંગઠિત ક્ષેત્રના ૨૦૦ કરોડ જેટલાં મજૂરો, મહિલાઓ અને યુવાનોની રોજગારી પર પણ ગંભીર અસર થઈ છે. આ કરોડો લોકોની દરરોજની રોજગારી અનિયમિત થઈ ગઈ હોવાથી તેમને ગંભીર આર્થિક સંકળામણનો સામનો કરવો પડે છે. ૨૦૨૧ના પ્રથમ ક્વાર્ટરમાં દુનિયામાં લગભગ ૧૪ કરોડ નોકરિયાતો પર નોકરી ગુમાવવાનું જોખમ ખડું થયું હતું. બીજા ક્વાર્ટરમાં ૧૨.૭ કરોડ લોકો નોકરી બચાવવા ઝડૂમી રહ્યા છે. યુએનની એજન્સીએ કહ્યું હતું કે માત્ર હેલ્થની બાબતમાં કોરોના પર કાબૂ મેળવવો એ જ લક્ષ્યાંક ન હોવો જોઈએ. બધા જ દેશોની ખાસ સમિતિ બનાવીને આર્થિક રીતે જે નુકસાન થયું છે તેની ભરપાઈ કરીને રોજગારી સર્જવાની દિશામાં પણ પગલાં લેવા જરૂરી છે.

ગ્રીનકાર્ડની સિસ્ટમ નાબુદ કરવા યુએસ કોંગ્રેસમાં બિલ રજૂ થયું

ભારતીય મૂળનાં અસંખ્ય નાગરિકોને ફાયદો થશે

વોશિંગ્ટન : અમેરિકન સંસદમાં ગ્રીનકાર્ડની સિસ્ટમમાં સુધારો રજૂ કરતાં ઐતિહાસિક બિલનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. કોંગ્રેસમેન ઝોઈ લોફગ્રીન અને જ્હોન કર્ટીઝે અમેરિકન સંસદગૃહમાં બિલ રજૂ કર્યું હતું. બિલમાં દેશ પ્રમાણે ગ્રીનકાર્ડ આપવાની સિસ્ટમ નાબુદ કરવાની હિમાયત થઈ છે.

અમેરિકા અત્યારે દેશ પ્રમાણે સાત ટકા નાગરિકોને ગ્રીનકાર્ડ આપે છે. જે દેશના નાગરિકો અમેરિકામાં રહે છે અને કાયમી પરવાનાની રાહ જોઈ રહ્યા છે, એમાંથી પ્રત્યેક દેશના સાત ટકા નાગરિકોને સિનિયોરિટીના આધારે ગ્રીન કાર્ડ મળે છે. તેના કારણે ભારત-ચીન જેવા અસંખ્ય દેશોના નાગરિકો બબ્બે-ત્રણ-ત્રણ દશકાથી ગ્રીન કાર્ડની રાહ જોઈ રહ્યા છે. માત્ર સાત ટકાના હિસાબે ગ્રીનકાર્ડની પરવાનગી

મળતી હોવાથી અન્ય નાગરિકોનો વારો આવતા વર્ષો નીકળી જાય છે. આ સ્થિતિ નિવારવા માટે હવે અમેરિકા કેટા સિસ્ટમને નાબુદ કરીને ગ્રીનકાર્ડ આપવાની પેશકશ કરી રહ્યું છે. જો બાઈડેનના શાસનકાળમાં આ માટે ઐતિહાસિક બિલ રજૂ થયું છે. ઈકવલ એક્સેસ ટુ ગ્રીન કાર્ડ્સ ફોર લીગલ એમ્પ્લોયમેન્ટ એક્ટ-૨૦૨૧ રજૂ થયું છે. જો આ બિલ સંસદમાં પસાર થઈ જશે તો અમેરિકામાં રહેતાં સંખ્યાબંધ ભારતીય નાગરિકોનો દાયકાઓનો ઈતજાર ખતમ થશે. તેમને આગામી બે-ત્રણ વર્ષમાં જ ગ્રીનકાર્ડ મળી જાય તેવી શક્યતા ઉજળી બની જશે.

આ બિલમાં બીજી એક જોગવાઈ એવી પણ કરવામાં આવી છે કે પરિવાર માટે વિઝાની મર્યાદા સાત ટકા છે. તે વધારીને ૧૫ ટકા કરવાની ભલામણ છે. એટલે કે જે વિદેશી નાગરિકો અમેરિકામાં રહે છે તેમાંથી સાત ટકાના પરિવારના સભ્યને અમેરિકામાં રહીને નોકરી ધંધાની પરવાનગી અપાતી હતી. તે સંખ્યા વધારીને ૧૫ કરવાનો પ્રસ્તાવ મૂકાયો છે. આ નવી જોગવાઈના કારણે આઈટી નિષ્ણાતોના પરિવારના સભ્યને અમેરિકામાં પહોંચવાનો માર્ગ વધુ મોકળો બનશે. બિલ રજૂ કરતી વખતે કોંગ્રેસમેને કહ્યું હતું કે દેશમાં ૧૯૮૦થી ઘણાં નાગરિકો પરમેનેન્ટ રેસિડેન્ટ કાર્ડ એટલે કે ગ્રીન કાર્ડની રાહ જોઈ રહ્યા છે. તેમને હવે ગ્રીનકાર્ડ આપી દેવાનો સમય થઈ ચૂક્યો છે.

SUPER VISA INSURANCE

Get Full REFUND if visa is declined
Get partial refund if parents leave early*
*conditions apply.... Ask NOW for a free quote..



Sanjiv Puri
Insurance Broker
Ph.: 416-890-3232
Email: sanjivpuri@rogers.com

StarLife
Insurance & Investments Inc.
www.starlifeinsurance.ca

LIFE INSURANCE | FUNERAL INSURANCE | MORTGAGE INSURANCE | CRITICAL ILLNESS INSURANCE | DISABILITY INSURANCE
SUPER VISA INSURANCE | INSURANCE FOR VISITORS / NEW IMMIGRANTS | RESP | ESTATE PLANNING | RRSP | RETIREMENT PLANNING

છેલ્લા ૪૪ વર્ષથી ટોરાન્ટોની સર્વ પ્રથમ ગુજરાતી ટ્રાવેલ એજન્સી. ૪૪ વર્ષથી ગુજરાતી પ્રજા અને ગુજરાતી ભાષા અમારી સફળતા માટે યજ્ઞભાગી છે. દિલથી આપનો અમે ખૂબજ આભાર માનીએ છીએ. સ્વાઈ મુસાફરી ની ટીકીટ માટે અમારા ભાવ ટોરાન્ટોમાં ખૂબજ આકર્ષક છે અજમાવી જુઓ... આપને આનંદ થશે.

Ashok Travels 416-977-9896 અશોક ટ્રાવેલ્સ ૪૧૬ ૯૭૭ ૯૮૯૬

Thank you for your continued support since last 44 years. We are glad to be your family travel agency and we feel proud to serve three generations with most competitive prices and excellent service.

www.ashoktravel.com

Ashok Travels Serving your travel needs in Canada since 1973
TICO # 1486999 238 Gerrard St. East, Suite 100 Toronto, ON M5A 2E8

✓ Residential
✓ New Condos
✓ Investments
✓ Commercial

દુઆમાં યાદ રાખશો

Zakir Patel
Broker

Cell: 416-561-7973
Office: 416-287-2222

RE/MAX COMMUNITY
Realty Inc., Brokerage

Independently Owned and Operated
1265, Morningside Ave. #203
Toronto, ON M1B 3V9
Email: patelzakir82@gmail.com

ક્રિકેટરસીયાઓને ICCની મોટી ભેટ, 8 વર્ષમાં 10 વર્લ્ડ કપ યોજવા નિર્ણય

PAGE NO. 19

ABOWATH
REAL ESTATE GROUP
VALUING RELATIONSHIPS OVER TRANSACTIONS EVERY SINGLE TIME!

MAAZ ABOWATH
BROKER
416 893 4585

More info on PAGE 2
વધુ માહિતી પાનું 2 પર

ABOWATH.COM

SS & LAWYERS LLP

- REAL ESTATE
- LITIGATION
- WILLS AND ESTATES
- AFFIDAVIT AND POWER OF ATTORNEY
- NOTARIZATION
- FAMILY LAW
- CORPORATION / COMMERCIAL TRANSACTIONS
- FRANCHISE CLOSING

1780 ALBION ROAD, UNIT # 8, TORONTO ONTARIO M9V 1C1

Avni Shah
B.A., JD
Barrister & Solicitor

ashah@sslawyers.ca
Tel : 416-818-4000
Fax : 416-740-4002





પહેલો નેશનલ વેક્સીન ઈન્જરી કોમ્પેન્સેશન પ્રોગ્રામ અમલી

વેક્સીનેશનને કારણે ગંભીર આડઅસર થઈ હોય તેવા લોકોને વળતર આપવામાં આવશે

ટોરોન્ટો

ડિસેમ્બર ૨૦૨૦માં કેનેડાએ નેશનલ વેક્સીન ઈન્જરી કોમ્પેન્સેશન પ્રોગ્રામ જાહેર કર્યો હતો. એનો અમલ સત્તાવાર રીતે મંગળવારે શરૂ થયો છે. જેનાથી જે કેનેડીયનને વેક્સીનને કારણે ગંભીર આડઅસર થઈ હોય, તેમને સરકાર તરફથી વળતર મળી શકશે.

વેક્સીન ઈન્જરી સપોર્ટ પ્રોગ્રામની જાહેરાત ડો. થેરેસા ટેમે એક નિવેદન કરતા કરી હતી. જેનાથી જેમને ૮મી ડિસેમ્બર, ૨૦૨૦ કે એ પછી અપાયેલી હેલ્થ કેનેડાની અધિકૃત વેક્સીનને કારણે જેમને ગંભીર અને કાયમી અસર પહોંચી હોય તેમને આર્થિક વળતર મળી શકશે. આ યોજનામાં લાભાર્થીને લાભ આપવા પહેલાં કેનેડામાં કંઈ



સમગ્ર કેનેડામાં 21મી મે સુધી વેક્સીનની આડઅસરના 5989 કિસ્સાઓ નોંધાયા

જગ્યાએ વેક્સીન અપાઈ હતી, કયા પ્રાંત કે વિસ્તારમાં વેક્સીનેશન થયું, વેક્સીનેશનની તારીખ કઈ છે અને વેક્સીનેશનને કારણે કોઈ કાયમી કે ગંભીર ઈજા થઈ છે કે એનાથી મૃત્યુ થયું છે તે બધી બાબતોને ધ્યાનમાં લેવાશે. પબ્લીક હેલ્થ એજન્સી ઓફ કેનેડા (પીએચએસી)ના જણાવ્યા મુજબ આ

વળતર એવા લોકોના વારસોને પણ મળશે જેમના સ્વજનનું વેક્સીન ઈન્જરીને કારણે મૃત્યુ થયું હોય. આ વળતર આપકના અન્ય સ્રોતના રૂપમાં પણ હશે. આ ઉપરાંત મૃતકોની અંતિમક્રિયા અને યોગ્ય તબીબી સારવારનો ખર્ચ પણ મળશે. વળતરની રકમ દરેક કેસમાં મુજબ જુદી જુદી

હોઈ શકે છે અને એનો અમલ ઈજા કે મૃત્યુની તારીખથી ગણાશે. ઈજાનો પ્રકાર દર્દીને થયેલી આડઅસર અને જીવનને ઉભો થયેલો ખતરો પીએચએસીના ધારાધોરણો મુજબના હશે. આ જાહેરાતનો અમલ હવે પછી થનારા તમામ વેક્સીનેશન માટે પણ હશે. આ યોજનાની પ્રાથમિક જાહેરાત ડિસેમ્બર ૨૦૨૦માં થઈ હતી અને કોવિડ-૧૯ના વેક્સીનેશનથી સંભવિત આડઅસરો વિશે નિષ્ણાંતોએ વ્યક્ત કરેલી ચિંતાઓને કારણે આ પગલું લેવાયું છે. ૨૧મી મે સુધી વેક્સીનની આડઅસરના ૫,૯૮૯ કિસ્સાઓ નોંધાયા હતા. જે વેક્સીનેશનના કુલ ડોઝના ૦.૦૨૯ ટકા હતા. એ પૈકી બે ડોઝથી વધુ કેસ વીઆઈટીટી સંબંધિત હતા. અન્ય ૧૪ કેસની હજુ તપાસ ચાલી રહી છે.

એર કેનેડાએ ટોચના અધિકારીઓને ૧૦ મિલિયન યુએસ ડોલર બોનસ પેટે ચુકવ્યા

ઓન્ટેરિયો : કોવિડ-૧૯ની મહામારીને પગલે ભારે ખોટનો સામનો કરી રહેલી એર કેનેડા અને સરકાર વચ્ચે કંપનીની બચાવ યોજના બાબતે ચર્ચા વિચારણા ચાલી રહી છે. ત્યારે જ કંપનીએ ટોચના અધિકારીઓ અને મેનેજર્સને અંદાજે ૧૦ મિલિયન યુએસ ડોલર જેટલું બોનસ ચુકવી દીધું છે. વર્ષ ૨૦૨૦માં એર કેનેડાએ મોટી ખોટને પગલે હજારો કર્મચારીઓને છૂટા કરી દેવા પડ્યા હતા. એર કેનેડાના શેર હોલ્ડર્સ માટેના વાર્ષિક સરકારી સહાયમાં આ બોનસની જોગવાઈની સ્પષ્ટતા કરવામાં આવી હતી. જે એક્ટીવિટી અને મેનેજરોએ પગારકાપનો સામનો કર્યો હતો.

તેમને વળતર તરીકે આ બોનસ આપવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવ્યું હતું. જો કે, એર કેનેડા ફેડરલ સરકાર સાથે કરોડો ડોલરના રાહત પેકેજ માટેની વાટાઘાટો કરી રહી હોવાથી આ બોનસ જાહેર થયું હોવાની પણ ચર્ચા છે.



વર્ષ 2020માં એર કેનેડાએ મોટી ખોટને પગલે હજારો કર્મચારીઓને છૂટા કર્યા હતા

એર લાઈન કંપનીના અધિકારીઓ જ કંપનીને ફરી બેઠી કરશે તેવી આશા

એર લાઈને શેર હોલ્ડર્સને શેર એવોર્ડ તરીકે ફાળવવા અને અધિકારીઓને બોનસ ચુકવવાની વાતને યોગ્ય ઠરાવતા કહ્યું હતું કે, મહામારી સમયે વરિષ્ઠ અધિકારીઓએ સંક્રમણને અટકાવવા ત્વરિત પગલાઓનો વ્યવસ્થિત અમલ કરાવીને કંપનીને વધુ નુકસાનથી બચાવી હતી. જેમાં અંદાજે ૨૦ હજારથી વધુ કર્મચારીઓને છૂટા કરવાના પગલાનો પણ સમાવેશ થાય છે. જેનાથી કંપનીના વર્કફોર્સમાં પચાસ ટકાનો ઘટાડો થયો હતો. જો કે, એરલાઈનને સરકાર તરફથી

કેનેડા ઈમરજન્સી વેજ સબસીડી અંતર્ગત દુપ્પ મિલિયન યુએસ ડોલરની સહાય પણ મળી હતી. જેને કારણે બાકીના કર્મચારીઓની રોજગારી ચાલી હતી. એ રીતે જ ટોચના અધિકારીઓએ કંપનીના શેરહોલ્ડર્સને એવા સંકેતો પણ આપ્યા હતા કે, મહામારી બાદ કંપની ઝડપથી ફરીથી બેઠી થઈ શકશે. એર લાઈને એક નિવેદનમાં એમ પણ કહ્યું હતું કે, કંપનીની નેતાગીરી જ કંપનીને ઝડપથી બેઠી કરી શકશે એવી આશા ટોચના અધિકારીઓ પાસે રાખીએ છીએ.

ઓન્ટેરિયોમાં રેસ્ટોરાં, જીમ અને રીટેલ વેપાર શરૂ કરવા માંગણી

ફેડરેશને લખેલા પત્રમાં સરકારની નીતિને ઝાટકણી કાઢી ટોરોન્ટો

ઓન્ટેરિયો સ્થિત ધી કેનેડીયન ફેડરેશન ઓફ ઈન્ડિપેન્ડન્ટ બિઝનેસ એન્ડ સરકાર સમક્ષ રેસ્ટોરાં, જીમ અને રીટેલ બિઝનેસને ઝડપથી ફરીથી શરૂ કરવા દેવાની માંગણી કરી હતી. જેનાથી ઓન્ટેરિયોના અર્થતંત્રને ફાયદો થઈ શકે. ફેડરેશને મંગળવારે જાહેર કરેલા ફોર્ડ સરકારને લખેલા પત્રમાં રીઓપનિંગ પ્લાનમાં વિલંબ બદલ ઝાટકણી કાઢવામાં આવી હતી. જે બીજા પ્રાંતોની સરખામણીમાં ઘણો નબળો હોવાનું પણ જણાવ્યું હતું. ફેડરેશને સરકારને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, અન્ય પ્રાંતોએ પણ મહામારી દરમિયાન લોકડાઉનનું પાલન કર્યું હતું. પરંતુ નોર્થ અમેરીકાના કોઈ વિસ્તારમાં અને વિશ્વમાં ઘણાં ઓછા

દેશોએ બિઝનેસ માટે આટલો લાંબો લોકડાઉન જોયો હશે, જેટલો ઓન્ટેરિયોએ જોયો છે. આ સમયગાળામાં ઓન્ટેરિયોમાં સ્કી હિલ્સ અને ગોલ્ફ કોર્સ જ નહીં બિનઆશયક રીટેલ કે પછી હેર સલૂન પણ બંધ રહ્યા છે. માત્ર ઓન્ટેરિયોમાં જ કોરોનાને કારણે લદાયેલા નિયંત્રણો વધુ રહ્યા હતા. બ્રિટીશ કોલંબિયામાં ક્યારેય ઈન સ્ટોર રીટેલ ગ્રાહકો માટે બંધ રહ્યા નથી. ઓન્ટેરિયોમાં પણ સ્ટે એટ હોમના નિયમની મુદત પૂર્ણ થઈ રહી છે. ઓન્ટેરિયોમાં હેર સલૂન પણ જુલાઈ સુધીમાં શરૂ થઈ શકે એમ નથી. એટલે ત્રીજા સ્ટેજમાં પૂર્ણ રીઓપનિંગ માટે હજુ જુલાઈના અંત કે ઓગસ્ટની જ રાહ જોવી પડશે. જો સરકાર રેસ્ટોરાં, જીમ અને રીટેલ ફરીથી શરૂ કરવાની મંજૂરી આપશે તો એનો ફાયદો વ્યાપારીઓ, ગ્રાહકોને તો થશે જ. પરંતુ પ્રાંતના અર્થતંત્રને પણ થશે. બાકી તો સરકારના આયોજન મુજબ સંપૂર્ણ રીઓપન થવામાં સપ્ટેમ્બર પણ આવી શકે છે.

અમેરિકા સરહદ ફરીથી ખોલવા કેનેડાવાસીમાં ઝાઝો ઉત્સાહ નહીં

ઓન્ટેરિયો

કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડો અને તેમની સરકાર કેનેડા-અમેરિકા વચ્ચેની સરહદને ખુલ્લી મુકવાનું આયોજન કરી રહી છે. પરંતુ કેનેડીયનોને સરહદ ફરીથી ખુલ્લી મુકાય એને માટે બિલકુલ ઉતાવળ નથી. ત્રણ ચતુર્થાંશ કેનેડીયનો પણ ચાહે છે કે જ્યારે પણ સરહદ ખુલ્લી મુકાય ત્યારે કેનેડા આવનારા તમામ લોકોએ વેક્સીનેશનનો પુરાવો આપવો જોઈએ. એન્ગસ રેઈડ ઈન્સ્ટીટ્યૂટ

અડધાથી વધુ કેનેડીયનો ઈચ્છે છે કે વિશ્વની સૌથી મોટી જમીન સરહદ સપ્ટેમ્બર સુધી બંધ રહેશે

કેનેડાની સરહદ પણ અનાવશ્યક સેવાઓ માટે બંધ કરી દેવામાં આવી હતી. અમેરિકા અને વિશ્વના બીજા દેશો માટેના પ્રવાસ પ્રતિબંધો વિશે દર મહિને થતી સમીક્ષા બાદ નિર્ણય લેવાતો રહ્યો છે. ગત અઠવાડિયે થયેલી સમીક્ષા બાદ કેનેડાએ પ્રતિબંધોને ૨૧મી જુન સુધી લંબાવી દીધા હતા. ૨૫મી મે એ એક બ્રિફિંગમાં વડાપ્રધાન ટ્રુડોએ કહ્યું હતું કે, કેનેડાની કુલ વસતિના અડધા લોકોને કોવિડ -૧૯ની વેક્સીનનો

પહેલો ડોઝ અપાઈ ચુક્યો છે. તેમણે અગાઉ કહ્યું હતું કે જ્યાં સુધી ૭૫ ટકા લોકોનું વેક્સીનેશન પૂર્ણ નહીં થાય ત્યાં સુધી સરહદ ખુલ્લી નહીં મુકી શકાય. જો કે ઓન્ટેરિયો, ક્યુબેક અને બ્રિટીશ કોલંબિયા જેવા પ્રાંતોએ રીઓપનિંગનું આયોજન પણ કરી લીધું છે.

કેનેડિયન મુસ્લિમોની હજયાત્રામાં પણ કોરોનાનું વિઘ્નના અણસાર

વેક્સીનેશનનું કાર્ય મંદગતિએ છે તેવા સમયે સાઉદીએ વેક્સીન ફરજિયાત કરી

ટોરોન્ટો

સાઉદી અરબિયાએ હજ માટે ત્યાં જનારા લોકો માટે કોવિડ-૧૯ની વેક્સીન ફરજિયાત કરી હોવાથી કેનેડીયન મુસ્લિમો આ વર્ષે કદાચ હજયાત્રાએ જઈ નહીં શકે એવા સંકેતો મળી રહ્યા છે. આ માર્ચમાં જ સાઉદી અરબિયાએ વેક્સીનેશનને ફરજિયાત કર્યું હોવાથી મક્કા-મદિનાની હજયાત્રાએ આવનારાઓની સંખ્યા ઓછી થઈ શકે છે.

વર્ષ ૨૦૨૦થી જ્યારથી મહામારી વિશ્વભરમાં ફેલાવાની શરૂઆત થઈ ત્યારથી જ સાઉદી અરબિયાએ હજયાત્રાઓની સંખ્યા ઉપર પ્રતિબંધો મુકી દીધા હતા. આ ઉપરાંત માત્ર સ્થાનિક લોકો જ એક હજારની મર્યાદામાં એકત્ર થઈ શકે એવો નિયમ અમલી કર્યો હતો. આ પહેલા દર વર્ષે લગભગ રમિલીયન લોકો હજયાત્રાએ જતા હતા. આ માસના આરંભે સાઉદી સરકારે ઉમરાહ ખાતેની મસ્જિદોની માત્રા વધારવાની યોજના



જાહેર કરી હતી. એ રીતે જ વિવિધ વિધિઓ માટેના રજિસ્ટ્રેશનની વ્યવસ્થા પણ કરાશે. એને માટે મોબાઈલ એપનો ઉપયોગ થશે અને યાત્રીઓને દરેક વિધિ માટેના સ્લોટની ફાળવણી થશે. જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો પુરો ખ્યાલ રાખવામાં આવશે. એ દરમિયાન હજયાત્રીઓના વેક્સીનેશન ઉપર પણ ધ્યાન રાખવામાં આવશે. ઓન્ટેરિયોના મુસ્લિમ સંગઠનો અને ટ્રાવેલ એજન્સીઓ હજયાત્રીઓના વેક્સીનેશન ઉપર ભાર મુકવાની બાબત ઉપર ધ્યાન આપવાની માંગણી કરી રહ્યા છે.

કિંગસ્ટનની ઈસ્લામિક સોસાયટીના કો-ઓર્ડિનેટર મુહમ્મદ બટે કહ્યું હતું કે, વેક્સીનેશન પોલીસી યોગ્ય છે. અમે એની સાથે સહમત છીએ. જ્યારે હજયાત્રા માટેની સરેરાશ વય ૬૧ વર્ષ રખાય છે. જે બાબત યુવા હજયાત્રીઓ માટે મોટી સમસ્યા બની શકે છે. કેમ કે, વેક્સીનેશન કાર્યક્રમમાં એમનો વારો ક્યારે આવશે એ જ મોટો સવાલ છે. કેનેડા સરકારની વેક્સીનેશન સાઈટ મુજબ ૪૦ ટકા કેનેડીયનોને કમસેકમ પહેલો ડોઝ અપાઈ ચુક્યો છે. પરંતુ કુલ વસતિના ૩ ટકાને જ ૧૨મી મે સુધી વેક્સીન મળી છે. કેનેડામાં વેક્સીનનો પહેલો ડોઝ વયજૂથ મુજબ એમના વિસ્તાર મુજબ અને એમના વ્યવસાય મુજબ અપાયો હતો. એટલે પાનખર સુધીમાં બધા કેનેડીયનોને વેક્સીન મળવાની શક્યતા ઓછી જણાય છે. લોકો પણ સમયની ગંભીરતાને સમજે છે અને આવા સમયમાં હજયાત્રા પુરા આયોજન સાથે થાય એ પણ જરૂરી છે.

કોરોનાની ગતિ મંદ : નવા 1143 કેસ, 16ના મોત

ઓન્ટેરિયોમાં સૌથી વધુ 870 કેસ અને 10ના મોત નોંધાયા, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 28455 તથા 1122 દર્દીઓની હાલત ગંભીર

ઓન્ટેરિયો : કેનેડામાં કોરોના વાયરસની ગતિ ધીમે ધીમે મંદ પડી રહી છે. ગુરુવારે સાંજ સુધીના વીતેલા 24 કલાકમાં સમગ્ર દેશમાં કોરોનાના નવા 1143 કેસ નોંધાયા હતા. જ્યારે દિવસ દરમિયાન 16 દર્દીએ દમ તોડ્યો હતો. ગુરુવારે કેનેડામાં કોરોના વાયરસના નવા 1143 દર્દીઓ મળી આવ્યા હતા. જેમાં સૌથી વધુ ઓન્ટેરિયો પ્રાંતમાં 870 કેસ કોરોના પોઝિટિવ તરીકે નોંધાયા હતા. અહીં 24 કલાકમાં 10 લોકોના મોત કોરોનાને કારણે થયા હતા. જ્યારે 1563 દર્દીઓ રિકવર થયા હતા. ક્યુબેકમાં આજે નવા 267 કેસ નોંધવા સાથે 6 દર્દીના મોત નોંધાયા હતા. જ્યારે મોન્ટોબામાં નવા 360 નાગરિકોમાં કોરોનાની પૃષ્ઠિ થઈ હતી. મોન્ટોબામાં ગુરુવારે 5 દર્દીએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો હતો. એ જ રીતે નોવા સ્કોશિયામાં ગુરુવારે નવા 25 કેસ મળવા સાથે 1 મોત થયું હતું. સાસ્કેચવાનમાં 131 નવા દર્દી ઉમેરાવા સાથે 100 દર્દી સાતા થયા હતા. ગુરુવારે સાંજસી સ્થિતિએ સમગ્ર દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 28455 રહી હતી. જ્યારે આ જ સમયે દેશમાં 1122 દર્દીઓની હાલત હોસ્પિટલમાં અત્યંત કટોકટ હોવાનું જાણવા મળ્યું હતું.



ઓન્ટેરિયોમાં શિયાળામાં શાળાઓ ખુલે તેવી શક્યતા તદ્દન નહિવત : પ્રિમીયર ફોર્ડ

ટોરોન્ટો : ઓન્ટેરિયોના વિદ્યાર્થીઓ માટે શાળામાં જઈને ભણી શકે એવા સંજોગો સપ્ટેમ્બર પહેલા નહીં આવી શકે એવી સ્પષ્ટતા પ્રિમીયરે બુધવારે પત્રકાર પરિષદમાં કરી હતી. તેમણે કહ્યું હતું કે, હું નથી ઈચ્છતો કે, બાળકોના સમર વેકેશનમાં કાપ આવે અથવા તો એમના આરોગ્ય સામે કોઈ ખતરો ઉભો થાય. એટલા માટે જ શાળાના વર્ગો ઝડપથી શરૂ કરવા માટેની માંગણીઓ પર અમે ધ્યાન નથી આપતા. આ અગાઉ સોમવારે તેમની સમક્ષ એવી રજૂઆત થઈ હતી કે, ઓનલાઈન શિક્ષણને બદલે કલાસરૂમ ફરીથી શરૂ કરી દેવા જોઈએ એવું નિષ્ણાંતો માની રહ્યા છે. જેના જવાબમાં ફોર્ડ આમ કહ્યું હતું. શિયાળા પહેલા શાળાઓ ખોલવામાં નહીં આવે એવી સ્પષ્ટતા તેમણે બુધવારની પત્રકાર પરિષદમાં કરી હતી. તેમણે કહ્યું હતું કે, પ્રાંતમાં હજુ પણ સંક્રમણના આંકડા ઓછા થયા નથી, એ તરફ પણ નિષ્ણાંતોએ ધ્યાન

આપવું જોઈએ. સંક્રમણનો દર છ ટકાથી વધીને ૧૧ ટકા જેટલો થયો છે. કેનેડાના ઘણાં પ્રાંતોમાં કલાસરૂમમાં શિક્ષણ શરૂ થયું હોવાની દલીલ સામે તેમણે કહ્યું હતું કે ઓન્ટેરિયોમાં જે સ્થિતિ છે એને જોઈને જ નિર્ણય લેવાશે. શાળા શરૂ થાય એ પહેલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો તથા શાળાઓના અન્ય સ્ટાફનું વેક્સીનેશન થવું એટલું જ જરૂરી છે. એટલે અત્યારે અમારું બધું ધ્યાન એ તરફ જ છે. એ વાત સાચી છે કે, ઓન્ટેરિયોના મોટાભાગના વિદ્યાર્થીઓ ૨૦૧૯ના એપ્રિલથી ઓનલાઈન શિક્ષણ મેળવી રહ્યા છે અને જ્યારે કોવિડના ત્રીજા વેવની સંભાવના સામે હોય, ત્યારે શાળાઓ ફરીથી શરૂ કરવાનું જોખમી પુરવાર થઈ શકે છે. આમ છતાં અમે સ્કુલ બોર્ડ સાથે ચર્ચા કરી આઉટડોર ગ્રેજ્યુએશન સેરીમની બધા ગ્રેડ માટે યોજાય એવી વ્યવસ્થા કરવા માંગીએ છીએ. જેથી શૈક્ષણિક સ્ટાફ અને શાળા સાથેનો વિદ્યાર્થીઓનો સંપર્ક પણ જળવાઈ રહે.

ઓટાવામાં હોટેલ ક્વોરોન્ટાઈનનો ઈન્કાર કરનારનો દંડ વધારી ૫૦૦૦ ડોલર કરાયો

ટોરોન્ટો

કેનેડામાં હવાઈ માર્ગે પ્રવેશનારા પ્રવાસીઓ માટે નિર્ધારિત હોટેલમાં ક્વોરોન્ટાઈનની જોગવાઈ છે. જે પ્રવાસી એનો ઈન્કાર કરે એને ૫૦૦૦ યુએસ ડોલરનો દંડ કરવામાં આવશે. આવનારા દરેક પ્રવાસીનો કોવિડ -૧૯ ટેસ્ટ થશે અને રીપોર્ટ આવે ત્યાં સુધી ફરજિયાત હોટેલમાં ક્વોરોન્ટાઈન રહેવું પડશે એવો નિયમ અમલમાં છે. જો કોઈ પ્રવાસી ટેસ્ટ કે હોટેલ ક્વોરોન્ટાઈનનો ઈન્કાર કરે તો દરેકના ૫૦૦૦ યુએસ ડોલરનો દંડ થાય એવી જોગવાઈ રાખવામાં આવી છે.



14મી એપ્રિલથી 24મી મે દરમિયાન 1000થી વધુ પ્રવાસીઓ પાસે દંડ વસૂલાયો

આ દંડની રકમ અત્યાર સુધી ૩૦૦૦ યુએસ ડોલર હતો. ફેબ્રુઆરીની ૨૨મી તારીખે સરકારે કેનેડામાં પ્રવેશનારા તમામ પ્રવાસીઓ માટે આગમન સમયે કોવિડ -૧૯નો ટેસ્ટ અને ત્રણ દિવસના હોટેલ ક્વોરોન્ટાઈનનો નિયમ જાહેર કર્યો હતો.

જોઈએ. કેમ કે હોટેલના ખર્ચના ૨૦૦૦ ડોલર ભરવાને બદલે એ તે સમયનો ૩૦૦૦ ડોલરનો દંડ ભરીને ક્વોરોન્ટાઈન ટાળવાની કોશિષ કરી શકે છે.

જો ટેસ્ટમાં પ્રવાસી કોરોના પોઝિટિવ આવે તો બાકીનો ક્વોરોન્ટાઈન સમય પ્રવાસી પોતાના ઘરે કે નક્કી કરેલી જગ્યાએ પુરો કરી શકે એવી જોગવાઈ પણ આ નિયમમાં હતી. હોટેલ ક્વોરોન્ટાઈનનો અંદાજે ૨૦૦૦ યુએસ ડોલરનો ખર્ચ પ્રવાસીએ ભોગવવાનો હતો.

૧૪મી એપ્રિલથી ૨૪મી મે દરમિયાન ૧૦૦૦થી વધુ પ્રવાસીઓને હોટેલ ક્વોરોન્ટાઈનનો ઈન્કાર કરવા બદલ દંડ કરવામાં આવ્યો હતો અને ૪૦૦થી વધુ એવા પ્રવાસીઓ જેમણે કોવિડ-૧૯નો ટેસ્ટ કરાવવાનો ઈન્કાર કર્યો હતો.

દંડમાં વધારાની જોગવાઈ સરકારની સલાહકાર સમિતિના અહેવાલને પગલે કરવામાં આવી હતી. જેમાં જણાવાયું હતું કે હોટેલ ક્વોરોન્ટાઈનને બદલે પ્રવાસીને પોતાના ઘરે જ ક્વોરોન્ટાઈન કરવા

જો કે દંડ વધવાથી હોટેલ ક્વોરોન્ટાઈનનો ઈન્કાર નહીં થાય એવું નથી. કેમ કે, કેટલાક પ્રવાસીઓ માને છે કે, હોટેલના રૂમને બદલે કોઈ પરિચિત કે મિત્રના ઘરમાં ક્વોરોન્ટાઈન થવું વધુ સલામત છે.

હોટેલમાં ક્વોરોન્ટાઈનના નિયમોનું પાલન બરાબર કરી શકાતું નથી. વળી ખર્ચનો ભોજો પણ પ્રવાસીઓ ઉપર ખોટી રીતે વધી જાય છે.

ટુડોને ઘૂંટણમાં ઈજા, ચાલવા માટે લાકડીનો સહારો

ઓટાવા

કેનેડાના વડાપ્રધાનને વીક એન્ડ દરમિયાન પોતાના સંતાનો સાથે ફિરસ્બીની રમત રમતી વખતે પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી. જેથી તેમને ચાલવામાં ખૂબ જ તકલીફ પડી રહી છે. હાલ તેઓ લાકડીના સહારે ચાલી રહ્યા હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સોમવારે એક ઈવેન્ટમાં તેમણે અચેત એન્ટરપ્રિન્યોર્સ માટેની ફેડરલ લોનની જાહેરાત કરી હતી. તેમના પ્રવક્તા એલેક્સ

વેસ્ટલેન્ડે કહ્યું હતું કે વિકેન્ડમાં વડાપ્રધાન પોતાના પરિવાર સાથે રજા ગાળવા ગયા હતા. ત્યારે સંતાનો સાથે ફિરસ્બીની રમત રમતી વખતે તેમને ઘૂંટીમાં ઈજા થઈ હતી. જો કે ઈજા કેટલી ગંભીર છે એ વિશે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. એટલે કેટલો સમય તેમણે લાકડીના સહારે ચાલવું પડશે એ જાણી શકાયું નથી. જો કે વેસ્ટલેન્ડે કહ્યું હતું કે, વડાપ્રધાનને હવે સારું છે અને ડોક્ટરોની સુચનાનો અમલ કરી રહ્યા છે.

THINKING OF INVESTING?

INVEST AS LOW AS \$50,000 IN REAL ESTATE

SECURED INVESTMENT with up to 8-12% Guaranteed Return

We have multiple avenues for investment in Residential Properties, Commercial Properties or Construction Projects **plus** your investment is secured against the assets.

રેસિડેન્શિયલ અને કોમર્શિયલ પ્રોપર્ટી અથવા કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ્સ માં અમારી પાસે ઘણાં જુદા જુદા રોકાણોનો વિકલ્પ છે જ્યાં તમને રોકાણ પર ૮-૧૨% સુધીનું વળતર અને તમારું રોકાણ સંપત્તિ સામે સુરક્ષિત હોય છે.

CALL 416 893 4585 TODAY!!!

MOHAMMAD ABOWATH
SALES REPRESENTATIVE

MAAZ ABOWATH
BROKER

IBRAHIM ABOWATH
SALES REPRESENTATIVE

416 893 4585

ABOWATH

REAL ESTATE GROUP

VALUING RELATIONSHIPS OVER TRANSACTIONS EVERY SINGLE TIME!

ABOWATH.COM

આપના વિશ્વાસુ અને ભરોસાપાત્ર

અમારી રીયલ એસ્ટેટ અને ઇન્વેસ્ટમેન્ટની મફત સલાહ નો લાભ ઉઠાવવા માટે આજે જ સંપર્ક કરો.

Call us TODAY for all of your Real Estate Needs and get Honest, Reliable and Courteous Service you can count on.

- ✓ Residential
- ✓ New Construction
- ✓ Investment
- ✓ Commercial

SHIV FINANCIAL SERVICES

VISITOR TO CANADA AND NEW IMMIGRANTS INSURANCE

Personal Tax - File is Free For New Immigrants.

Full Time Service Provider

Serving Community Since 2009

- Life Insurance, Critical Illness Insurance & Mortgage Insurance with Money Back Option
- Health & Dental Plan
- Segregated Fund • Personal Tax-file

* અમે બધી ટોપની ઇન્સ્યુરન્સ કંપનીઓનું પ્રતિનિધિત્વ કરીએ છીએ.

* New Life Insurance Advisors are recruited.

જગદીશ સેવક (Financial Advisor)
Cell: 647-236-7620

For Free Quotation & Consultation

SHIV FINANCIAL SERVICES
"Proper insurance coverage is Peace of Mind"
Email: sevak_2007@hotmail.com
www.shivfinancialservices.ca

GUARANTEED LOWEST PREMIUM



તંત્રી સ્થાનેથી

મ્યુકોરમાઈકોસિસ : અશુદ્ધ ઓક્સિજનથી વધુ એક મહામારી


 તંત્રી - પ્રકાશક
 સ્વદેશ

કોરોનાના કેર બાદ હવે દુનિયાને કેટલાક દેશમાં મ્યુકોરમાઈકોસિસ નામની નવી આફત આવી પડી છે. કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓમાં આ બિમારી જોવા મળે છે. આ રોગમાં બ્લેક ફંગસ થવાથી દર્દીના દાંત, જડબા કે આંખ સુદ્ધા કાઢી નાંખવામાં આવે છે. અત્યાર સુધીમાં આ રોગમાં મૃત્યુદર 50 ટકાથી વધુ હોવાથી તે ન થાય તેની કાળજી રાખવી ખૂબ જરૂરી છે. અમેરિકામાં થયેલા લેબ રીસર્ચ પ્રમાણે દુનિયામાં દર એક કરોડે 17 વ્યક્તિને બ્લેક ફંગસનો શિકાર થાય છે. માઈકો ઓર્ગેનિઝમ જર્નલ અનુસાર ભારતમાં બ્લેક ફંગસનું પ્રમાણ દુનિયામાં છે, તેના કરતા 70 ગણું વધારે છે. કોરોના સામેની લડાઈ હજી ઘણી બધી બાકી છે ત્યાં કેન્દ્ર સરકારે રાજ્યોને વધુ એક રોગને મહામારી જાહેર કરવાનો આદેશ આપ્યો છે. 12 દિવસ પહેલાં જ ભારતના પાંચ રાજ્યોમાં તેને મહામારી જાહેર કરાઈ હતી. માણસનું શરીર અબજો બેક્ટેરિયાનું ઘર છે. આ ઉપરાંત આપણા શરીરમાં કુગ પણ હોય છે. નાકમાં, બગલમાં, ચામડી પર તે હોય છે. જો કે, મોટાભાગના કિસ્સામાં આપણે તેનાથી અજાણ હોઈએ છીએ. કારણ કે, આપણી રોગપ્રતિકારક ક્ષમતા વધુ હોય તેથી રોગ શરીરને ઝાઝુ નુકસાન પહોંચાડી શકતો નથી. કોરોનાની પ્રથમ લહેરમાં બાળકોને બિલકુલ અસર થઈ ન હતી. જ્યારે બીજી લહેરમાં બાળકોને થોડીક અસર રહી છે. જેનું મુખ્ય કારણ પણ બાળકોની ઈમ્યુન સિસ્ટમ જ છે. બાળકોમાં રોગપ્રતિકારક શક્તિ વધુ હોય છે. કુગ અને બેક્ટેરિયા પ્રકૃતિના ડિકમ્પોઝર છે. પ્રાકૃતિક વિઘટકો છે. તેનું કામ પદાર્થનું વિઘનટ કરીને જુદા-જુદા ઘટકોને મુક્ત કરવાનું છે. હેલ્થી શરીરમાં કુગ પોતાનું કામ કરી શકતી નથી. જો શરીર માંદું હોય, ઈમ્યુન સિસ્ટમ નબળી પડી ગઈ હોય તો કુગ તરત જ પોતાનું વિઘનનું કાર્ય શરૂ કરી દે છે. મૃતદેહમાં કુગ બહુ ઝડપથી પોતાનું કામ કરતી હોય છે. હેલ્થી શરીરમાં નહીંવત અને શરીર જેમ માંદું પડતું જાય તેમ કુગ પોતાનું કામ ઝડપથી કરવા માંડે છે. ભારતમાં સત્તાવાર રીતે બે કરોડ લોકો કોરોનાનો શિકાર બની ગયા છે. કોવિડ થોડા દિવસોમાં મટી તો જાય છે, પણ ઈમ્યુન સિસ્ટમને તહસ-નહસ કરી નાખે છે. અહીં મ્યુકોર માઈકોસિસને મોકળો માર્ગ મળી શકે છે. જે લોકોને કોરોના થયો છે તે બધાને બ્લેક ફંગસ એટલે કે મ્યુકોર માઈકોસિસ થાય એ જરૂરી નથી. પરંતુ કોવિડ ગયા પછી જેમની ઈમ્યુનિટી વધી નથી અને જે કાળી કુગના સંપર્કમાં આવી જાય છે તેમના પર આ ખતરો અધિક છે. બ્લેક ફંગસમાં મૃત્યુદર ૫૦ ટકાથી વધુ હોવાનું નોંધાયું છે. સ્કીન પર થતી ફંગસ સૌથી ઓછી જોખમી છે. તેમાં જીવ જવાનો ખતરો બહુ ઓછો છે. તેની સામે બ્લેક ફંગસ વધારે જોખમી છે અને વાઈટ ફંગસ એના કરતા પણ વધારે જોખમી છે. મ્યુકોર માઈકોસિસ છે એ મ્યુકોર નામની કુગને લીધે થાય છે. દર્દીઓમાં સાઈનસ, મગજ, આંખ, નાક અને ફેફસાંમાં તેનો ચેપ જોવા મળે છે. કોરોનાને લીધે કરોડો લોકોની ઈમ્યુનિટીમાં જંગી ઘટાડો થયો અને ફંગલ ઈન્ફેક્શનનો માર્ગ મોકળો થયો છે. પરંતુ આને અંતિમ કારણ પણ માની લેવાય નહીં. અન્ય એક કારણ સ્ટેરોઈડનો ઉપયોગ છે. બ્લેક ફંગસ મોટાભાગે જેમને બ્લડ શુગરનું પ્રમાણ વધારે હોય તેમને થાય છે. કોવિડની રેમડેસિવિર સહિત ઘણી બધી દવા એવી છે જે સ્ટેરોઈડ છે, જેના લીધે શરીરમાં શુગર લેવલ વધી જાય છે. કેટલાક તબીબો લોજિકનો વિરોધ પણ કરે છે.

તેઓ કહે છે કે સ્ટેરોઈડનો ઉપયોગ તો આપણે વર્ષોથી કરતા આવ્યા છીએ. ત્યારે તો બ્લેક ફંગસનો રોગ જોવા ન મળ્યો. તો હવે કેમ? વર્ષો સુધી જેમના પર સ્ટેરોઈડનો પ્રયોગ થયો હોય એવા દરદીઓ પણ આપણે ત્યાં છે. તો તેમને અત્યાર સુધી બ્લેક ફંગસ કેમ ન થયો? તેમની આ દલીલ વાજબી પણ લાગે છે. કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનની અછત વર્તાઈ હતી. આવી સ્થિતિમાં ભારતમાં ઈન્ડિસ્ટ્રીઅલ ઓક્સિજનનો પણ ઉપયોગ કરવાની નોખત આવી. કેટલાક તબીબો એવું કહે છે કે કોવિડના દર્દીઓને આપવામાં આવેલા અશુદ્ધ ઓક્સિજનને કારણે બ્લેક ફંગસની સમસ્યા ઉભી થઈ છે. ઈન્ડિસ્ટ્રીઅલ ઓક્સિજન નુકસાનકારક છે. મેડિકલ ઓક્સિજન પણ દર્દીને આપતા પહેલા તેનું હ્યુમિડિફિકેશન (આદ્રકરણ) કરવું પડે છે. હ્યુમિડિફિકેશન કરવા માટે ઓક્સિજનને સ્ટેરાઈલ વોટર (જંતુમુક્ત પાણી)માંથી પસાર કરવો પડે છે. આ પાણી વારંવાર બદલવું પણ પડે છે.

ઓક્સિજનનું હ્યુમિડિફિકેશન કરતી વખતે વપરાયેલું પાણી અશુદ્ધ હોય તો બ્લેક ફંગસનું જોખમ પેદા થાય છે. ડોક્ટરોએ આપેલું આ ત્રીજું કારણ મ્યુકોર માઈકોસિસની સમસ્યા માટે કંઈક અંશે વધુ પડતું જવાબદાર છે તેમ માની શકાય તેવું છે. સૌથી પહેલા મ્યુકોરમાઈકોસિસના કેસ ગુજરાત અને મહારાષ્ટ્રમાં જોવા મળ્યા હતા. ભારતના પાંચ રાજ્ય મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, હરિયાણા, તેલંગાણા અને ગુજરાતમાં બ્લેક ફંગસના અત્યાર સુધીમાં ૩,૨૦૦ કેસ નોંધાઈ ચૂક્યા છે. ૮૦ જણાના મોત થઈ ચૂક્યા છે. અમદાવાદની ફક્ત એક હોસ્પિટલમાં મ્યુકોર માઈકોસિસના ૩૬૮ કેસ છે. પ્રાઈવેટ હોસ્પિટલમાં આ રોગની સારવાર ટુ બીએચકેના ફ્લેટ કરતાય મોંઘી છે. બ્લેક ફંગસ રેર ડિસીઝ છે. અમેરિકામાં થયેલા લેબ રીસર્ચ પ્રમાણે દુનિયામાં દર એક કરોડે ૧૭ વ્યક્તિને બ્લેક ફંગસ થાય છે. ભારતમાં ૧૨ સેન્ટર પર ૨૧ મહિનાના આંકડા જમા કરવામાં આવ્યા તો જાણવા મળ્યું કે એક સેન્ટર પર દર વર્ષે મ્યુકોરમાઈકોસિસના ૨૨ દરદી આવે છે, પણ છેલ્લા એક મહિનામાં આ જ સેન્ટરોમાં ૧૧૦ દરદીઓ જોવા મળ્યા છે. મતલબ ભારતમાં બ્લેક ફંગસે પાંચ ગણો કુદકો માર્યો છે. હજી કેટલા વધે તેનો અંદાજ નથી. બ્લેક ફંગસ મટાડવા માટે એમ્ફોટેરિસિન-બી નામની દવાનો ઉપયોગ થાય છે, જે ભારતની જ ફાર્મા કંપની બનાવે છે. આ દવા આમ તો મળી જતી હતી, પરંતુ બ્લેક ફંગસે ઉછાળો મારતા તેની પણ અછત વર્તાવા માંડી છે. સરકાર હવે આ બાબતે ધીમે ધીમે સજાગ થઈ રહી છે. તેણે શહેર વાઈઝ હેલ્પલાઈન નંબર પણ જાહેર કરી છે દવા કે ઈન્જેક્શનને સીધા હોસ્પિટલમાં જ પહોંચાડવા વ્યવસ્થા ગોઠવવાની વેતરણ ચાલુ કરી છે. મ્યુકોર માઈકોસિસના લક્ષણમાં નાક બંધ થઈ જવું, નાકમાંથી લોહી અથવા કાળો તરલ પદાર્થ બહાર નીકળવો, આંખમાં સોજો અને દરદ, ધૂંધળું દેખાવું, અંધાપો જેવી બાબત છે. આ ઉપરાંત નાકની આસપાસ કાળા ડાઘા થવા, આંખમાં ડાઘા દેખાવા, મોંમાં ચાંદા પડવા, જડબા આસપાસ બ્લેક સ્પોટ દેખાવા વગેરે પણ કુગનો કલર બ્લેક હોવાથી તે જ્યાં કોલોની બનાવે ત્યાં બ્લેક સ્પોટ દેખાય છે. મ્યુકોરમાઈકોસિસમાં સર્જરી પણ કરવી પડે છે. જેટલા ભાગમાં ગેન્ગ્રીન થયું હોય તે અંગ કાપી નાખવું પડે છે. સામાન્ય માણસે મ્યુકોરમાઈકોસિસથી બચવા માટે ઈમ્યુનિટી સ્ટ્રોંગ રાખવા સાથે સારું ખાવ, નિયમિત કસરત કરવી અને પૂરતી ઊંઘ લેવી આવશ્યક છે.

manoj1968@yahoo.ca

RE/MAX
REALTY SERVICES
 INC., BROKERAGE
 INDEPENDENTLY OWNED AND OPERATED

JAY PATEL
 BROKER

 647.241.3818
 jaypatel1323@gmail.com

"Let Me Make Your Dream Home Into A Reality"
Residential, Commercial & Investment in Real Estate

 Off : 905.456.1000 | Fax : 905.456.1924
 295 Queen Street East, Brampton, On., L6W 3R1

ARISTO PEST CONTROL
 Set your mind at rest, we will get rid of the pest

647-339-3926 | aristopest@gmail.com | www.aristopestcontrol.com


 ✓ Mice
 ✓ Rat

SAME DAY SERVICE - RESIDENTIAL, COMMERCIAL, INDUSTRIAL

 ✓ Cockroach
 ✓ Bedbug

WE SPEAK ENGLISH, GUJARATI & HINDI

 ✓ Animal Control
 ✓ Bird Control
 ✓ WASPS and
 ✓ Hive Removal

24 HRS / 7 DAYS EMERGENCY SERVICES AND ANIMAL REMOVAL

We also provide No Obligation Inspection for Commercial and Residential Clients.

Written Guarantee And Discounted Rates

CALL SANKET TRIVEDI - 647.339.3926
 Government Licensed Structural Exterminator

ગોવર્ધનથાળ

સ્વાદિષ્ટ શુદ્ધ શાકાહારી ગુજરાતી ભોજન

Weekend Special

રગડા પેટિસ, પાંઉભાજી,
છોલેપુરી, કટલેસ,
ખાસ્તા ક્યોરી,
સેવ ઉસળ, સમોસા ચાટ

Takeout & Catering

Limited થાળી
(with sweet & Farsan)

\$8.00 +Tax

Limited થાળી
(without sweet & Farsan)

\$6.50 +Tax



CATERING SPECIAL

\$ 7.99 10 items

+Tax

Sweet, Farsan, Subji,
Kathor, Puri, Dal, Rice
Papad, Pickle, Kachumber

Franchise
Opportunity
in GTA

Call us for details

રસોઈકામ
કરી શકે તેવા
બહેનોની જરૂર છે.

ફોન નં: ૪૧૬-૪૩૮-૦૫૪૪

૪૧૬-૫૨૦-૨૯૨૨, ૪૧૬-૪૩૪-૮૧૨૧

૯૪૦, મારખમ રોડ, સ્કારબોરો, ઓન્ટેરીયો, કેનેડા, M1H2Y2

દેશ-વિદેશથી ટોરન્ટો ભણવા આવતા ગુજરાતી
(વેજીટેરીયન) સ્ટુડન્ટ, ભાઈઓ તથા બહેનોની ખાસ
સગવડ માટે તુષાર શાહ તથા ગોવર્ધન થાળ શરૂ કરે છે

ગુજરાત ભવન

જેમાં આપને સ્પેશિયલ રૂમ, શેરીંગ રૂમ, ગુજરાતી વેજીટેરીયન ભોજન,
પ્રાઈવેટ બેડ, Wi Fi ઇન્ટરનેટ વગેરે સગવડો આપવામાં આવશે.



ગુજરાત ભવન

Quarantine
Special
Package

\$73 Per Day



Call : Tushar Shah - 416-434-8121

ગુજરાત ભવન - 416-913-7184

4694 Kingston Road, Scarborough.



દેશમાં જર્જરિત થયેલા જિનાલયોના જિણોદ્ધાર કરાશે : સુરતથી શ્રીગણેશ

બારડોલીના કોર્પોરેટરનો અશ્લિલ વીડિયો વાયરલ થતા પક્ષની ફજેતી

સુરત

સુરતનાં 40 જિનાલયોમાં કામ સંપન્ન: બારીક કોતરણીનું પણ શુદ્ધિકરણ થશે

સુરત

જૈનાચાર્ય યોગતિલકસૂરિશ્વરજીના માર્ગદર્શન હેઠળ આગામી ત્રણથી ચાર વર્ષમાં દેશના તમામ જિણ થયેલા જિનાલયોને શુદ્ધ કરાશે. જેની શરૂઆત સુરતથી થઈ ગઈ છે.

જિનાલય શુદ્ધ સુરક્ષા દેશ વ્યાપી કાર્યક્રમનો આગાઠ સુરતથી તા-૨૭ ડિસેમ્બર ૨૦૨૦થી કરવામાં આવ્યો હતો. આ અંગે અધ્યાત્મ પરિવારનાં વિદ્યુત શાહ અને હર્ષદ કોઠારીએ જણાવ્યું કે અધ્યાત્મ પરિવાર દ્વારા જિન

શાસનને ઉજાળતા અનેક પ્રકલ્પો હાથ ધરાયા છે જે પૈકી આ એક છે. સુરતમાં અંદાજિત ૨૫૦ જેટલા જિનાલયો છે. જેમની મંજૂરી મળશે એ તમામ જિનાલયનું શુદ્ધિકરણ કરવામાં આવશે. અત્યારસુધીમાં શહેરમાં ૪૦ જેટલા જિનાલયોમાં આ કામ નિર્વિઘ્ને સંપન્ન થયું છે. સુરતમાં અનેક પ્રાચિન જિનાલયો છે જેમાં ઘણા બધા જિણ થઈ ચુક્યા છે. ઘણા એવા પણ હતા જેનું બન્યા પછી ક્યારેય સંપૂર્ણ શુદ્ધિકરણ નથી થયું. શુદ્ધ સુરક્ષા અંતર્ગત શિખરથી લઈને છોક

નીચે રંગમંડપ સુધી તેની સફાઈ થાય છે. જે જગ્યાએ પાણીનો વપરાશ ન થઈ શકે ત્યાં હાથથી જ સફાઈ કરવામાં આવે છે. ફ્લોરિંગ, દિવાલ, સ્તંભ, ખૂણાઓ અને બારિક કોતરણી સહિત તમામ જગ્યાએ શુદ્ધિકરણ સાથે જરૂર પડે ત્યાં તીરાડોમાં પુરાણ પણ કરવામાં આવે છે. લિકેજની સમસ્યા સાથે વિવિધ ઉપકરણોની સમસ્યાનો પણ નિકાલ કરવામાં આવે છે. સૌથી મહત્વની વાત એ છે તમામ સફાઈ એકદમ જયણાપુર્વક કરવામાં આવે છે.

બારડોલી નગરપાલિકાના ભાજપના કોર્પોરેટર દક્ષેશ શેઠનો અશ્લિલ વીડિયો વાયરલ થતા ફરી એકવાર ભાજપની ફજેતી થઈ છે. થોડા સમય પહેલા છોટા ઉદેપુરમાં પણ એક યુવતીએ ભાજપના મોટા નેતા પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેવામાં ભાજપના કોર્પોરેટર દક્ષેશ શેઠના વીડિયો કોલ પર રુપલલના સામે નગ્ન થઈને હસ્તમૈથુન કરતો વીડિયો વાયરલ થતા ચકચાર મચી છે.

દક્ષેશ શેઠ બારડોલી નગરપાલિકાના વોર્ડ નંબર એકના કોર્પોરેટર છે. વીડિયો વાયરલ થતાં તાત્કાલિક અસરથી નગરસેવકને સસ્પેન્ડ કરી

દેવાયા હતા. નગરસેવકના આ ૧ મિનિટ ૫૦ સેકન્ડના વીડિયોમાં સૌથી પહેલા રુપલલના કપડાં ઉતારે છે અને નગ્ન થઈને યુવતી બીભત્સ હરકતો કરવા લાગે છે. જે બાદ ભાન ભૂલીને નગરસેવક પોતે પણ કપડાં ઉતારી સંપૂર્ણ નગ્ન થઈ જાય છે અને બીભત્સ હરકતો કરવા લાગે છે.

વીડિયોમાં રુપલલના પોતાની ઓળખ છૂપાવવા મોઢું છુપાવી રહી છે પરંતુ લલનાને જોઈને લાળ ટપકાવતાં નગરસેવક કેમેરામાં કેદ થઈ જાય છે. નગરસેવક સાથેનો આ વીડિયો રેકોર્ડ કરવામાં આવે છે અને પછી તેને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવાયો છે.

સુરતમાં કરફ્યુમાં લગ્ન... ભાજપી નેતાના ભત્રીજાને ત્યાં પોલીસ ત્રાટકી

સુરત

ખટોદરા પોલીસ મથકનો સ્ટાફ ગત રવિવારે રાત્રે કરફ્યુનું પાલન કરાવી રહ્યો હતો ત્યારે રાત્રે બાતમીને આધારે અલથાણ કેનાલ રોડ પર સાઈકેલ બંગ્લોઝના પાર્ટી પ્લોટમાં રેડ કરાતા અહીં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. પોલીસે તપાસ કરતા સંજય હરીલાલ મહાત્મા (ઉ.વ.૬૦, રહે- સાઈકેલ બંગ્લોઝ, અલથાણ કેનાલ રોડ)એ અહીં ફંક્શનનું આયોજન કર્યું હતું. પાર્ટી પ્લોટમાં ગ્રહશાંતિ પ્રસંગ યોજાયો હતો. જેમાં પરિવારના સભ્યો-સંબંધીઓ હાજર રહ્યા હતા. પોલીસે જાહેરનામા ભંગ અન્યથે સંજય મહાત્મા સામે ગુનો દાખલ કર્યો હતો.

સુરતના કઠોરમાં રોગચાળાએ માથું ઉચક્યું ત્રણ દિવસમાં ઝાડા-ઉલ્ટીથી 6 લોકોના મોત

કઠોર: કામરેજ તાલુકાના કઠોર ગામનું વિવેકનગર કોલોની જે સુરત મહાનગર પાલિકામાં સમાવિષ્ટ છે. આ વિસ્તારમાં જાન્યુઆરી મહિનાથી બીમાર પડવાનું શરૂ થયું હતું. સ્થાનિકો દ્વારા રજૂઆત કરવા છતાં તંત્ર જાગ્યું નહીં અને છેલ્લા ત્રણ દિવસમાં 6 લોકોના દુષ્ક્રિયા પાણી પીવાથી મોત થતા તંત્ર દોડતું થઈ ગયું છે.

વિવેકનગર કોલોનીમાં ત્રણ દિવસથી 100થી વધુ લોકો દુષ્ક્રિયા પાણી પીવાથી બીમાર પડતા તમામ લોકોને સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.

સ્થાનિક આગેવાનો દ્વારા આક્ષેપ કર્યા હતા કે જો જાન્યુઆરી મહિનામાં રજૂઆત કરી ત્યારે તંત્ર જાગ્યું હોત તો કદાચ આજે વિવેક નગરના લોકો બીમારીનો ભોગ બન્યા ના હોત. વિવેકનગર કોલોનીમાં પીવાના પાણીની લાઈન અને ગટર લાઈનનું પાણી ભેગું થતા પાણીજન્ય રોગે માથું ઉચકતા આખો વિસ્તાર ઝાડા ઉલ્ટીમાં સપડાતા ફફડાટ મચી ગયો હતો. ખાસ કરીને બાળકો પણ કોલેરાનો ભોગ બનતા તંત્ર દોડતું થઈ ગયું હતું. હાલતો સુરત મહાનગર પાલિકાનું ડ્રેનેજ વિભાગ અને આરોગ્ય વિભાગ ઘટના સ્થળે દોડી આવી કામે લાગ્યા હતા.

બે મહિનાથી બંધ સી પ્લેન સર્વિસ ફરી શરૂ થવા અંગે અનિશ્ચિતતા

ભરૂચ

અમદાવાદથી કેવડિયા વચ્ચેની આ સી પ્લેન સર્વિસ ગત મહિનાના પ્રારંભથી બંધ કરી દેવામાં આવી હતી. સી પ્લેનના એરક્રાફ્ટને પણ માલ્ડિવ્સ પરત મોકલી દેવામાં આવ્યું છે. એક અધિકારીએ જણાવ્યું કે, 'કોરોનાના કેસમાં વધારો થતાં જ સી પ્લેન સર્વિસ બંધ કરવામાં આવી છે. હવે સી પ્લેન ફરી ક્યારે શરૂ કરવામાં આવશે તેને અંગે કોઈ પણ ટિપ્પણી કરવી મુશ્કેલ છે.' સી પ્લેન સર્વિસ માટે વનવે ટિકિટનો દર રૂપિયા ૩૫૦૦થી વધુ રાખવામાં આવતાં તેને ખૂબ જ ઓછા મુસાફરો મળી રહ્યા હતા. અધૂરામાં પૂરું કોરોનાના કેસમાં વધારો થતાં સી પ્લેનને મુસાફરોની સંખ્યામાં વધુ ફટકો પડ્યો હતો.

THANK YOU FRONTLINE WORKERS

**MORTGAGE DILIGENT**
A STEP AHEAD

FSRA # 10252

Purchase Refinance Renewal/Switch

5 Yrs Fixed @ 1.60%* High Ratio Only**5 Yrs Variable @ 1.14%* High Ratio Only****Rakesh Patel****
Vice President- Commercial.**Pranay Jani *****Nilesh Tailor *****Tushar Patel*****Bala Shah*****Vijay Rana*****Rajesh Khurana, MBA**
Principal Broker

Tel.: 289 521 6900

1305 Matheson Blvd E, Mississauga ON L4W 1R1

• info@mortgagediligent.com • www.mortgagediligent.com

Cell : 416-616-1300

દેશનો પહેલો પ્રોજેક્ટ : મોઢેરા સૂર્યમંદિર હવે આખો દિવસ સૂર્યોર્જીથી ઝગમગશે

વડાપ્રધાન મોદીના હસ્તે જ આ પ્રોજેક્ટનું લોકાર્પણ થશે, 69 કરોડનો ખર્ચ થશે

મોઢેરા

સૂર્ય 'દેવ'ની આરાધના માટે ચૌલુક્ય વંશના રાજા ભીમ પહેલા દ્વારા ૧૧મી સદીમાં મહેસાણા જિલ્લાના મોઢેરા ગામ ખાતે બંધાયેલા ઐતિહાસિક સૂર્યમંદિરને સૂર્યોર્જીથી જ પ્રજ્વલિત કરવાનો નવતર પ્રોજેક્ટ ગુજરાત સરકાર કેન્દ્રના સહયોગથી હાથ ધરી રહી છે, જે આ મહિનાના અંત સુધીમાં પૂર્ણ કરવાનો ટાર્ગેટ છે, બાદમાં વડા પ્રધાન મોદીના હસ્તે જ આ પ્રોજેક્ટનું લોકાર્પણ થશે. વિશેષતા એ છે કે, બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ-બીઈએસએસ ધરાવતા આ પ્રોજેક્ટમાં ઉત્પાદિત સોલર એનર્જીનો ઉપયોગ રાત્રે પણ થશે. ભારતમાં પહેલીવાર આ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો હોવાનો દાવો કરાઈ રહ્યો છે.



લિમિટેડએ ટેન્ડરિંગ દ્વારા મહિન્દ્રા જૂથની કંપની મેસર્સ મહિન્દ્રા સસ્ટેન પ્રાઈવેટ લિમિટેડને સોંપાયો છે, જેણે દક્ષિણ કોરિયાથી ટેકનોલોજી આયાત કરી છે.

૩. ૬૯ કરોડનો કુલ ખર્ચ ધરાવતો આ પ્રોજેક્ટ, રાજ્ય સરકારની નોડલ એજન્સી-ગુજરાત પાવર કોર્પોરેશન

સૂર્યમંદિરથી ત્રણ કિલોમીટર દૂર સુજાનપુરા ખાતે રાજ્ય સરકારે ૧૨ હેક્ટર જમીન ફાળવી છે, જ્યાં જમીનમાં પિલર ઉપર સોલર ફોટોવોલ્ટેઈક પેનલો લગાવી ત્રણ મેગાવોટના એક એવા બે યુનિટ કુલ

૬ મેગાવોટ ક્ષમતાવાળા ઊભા થશે, સાથોસાથ લિથિયમ બેટરીવાળી બીઈએસએસ ટેકનોલોજી સર્જાશે. અહીં ઉત્પાદિત સોલર એનર્જી મોઢેરા ગામના કુલ ૧,૬૧૦ ઘરોને તથા સૂર્યમંદિરને દિવસરાત પૂરી પાડવામાં આવશે. કુલ ઘરો પૈકીના ૨૭૧ ઘરો ઉપર એક-એક કિલોવોટની રૂફટોપ સિસ્ટમ પણ લાગી રહી છે, જે વીજળી ઘરમાલિકો ગ્રીડમાં વેચી પણ શકશે, જેને માટે સ્માર્ટ મીટર પણ લાગશે.

કોરોના મહામારીથી ઉત્તર ગુજરાતમાં ટ્રાવેલ્સ ધંધાને ૩૦૦ કરોડનો ફટકો

મહેસાણા

કોરોના કાળના દોઢ વર્ષના સમયગાળામાં ટ્રાવેલ્સના વ્યવસાયને મોટો આર્થિક ફટકો પડ્યો છે. દેશના પર્યટક અને ધાર્મિક સ્થળો ઉપર પ્રવાસીઓ માટે પ્રતિબંધ કરાયો હોવાથી તેની વિપરીત અસરો જોવા મળે છે. મહેસાણા, પાટણ, બનાસકાંઠા તેમજ સાબરકાંઠામાંથી ૧૦૦૦થી વધુ લકઝરી બસોનું સંચાલન થાય છે પરંતુ તે પૈકીની ૭૫ ટકા જેટલી લકઝરીને સંચાલકો નોન યુઝમાં મુકી દેવા મજબૂર બન્યા છે. મંદ પડેલા ટ્રાવેલ્સના ધંધાને કારણે સંચાલકોને દોઢ વર્ષના સમયગાળામાં અંદાજિત રૂ.૩૦૦ કરોડના નુકશાન થયું હોવાનું અનુમાન છે.

સૌથી વધુ રહેતી હતી. પરંતુ છેલ્લી બે સિઝનથી હાઉસફૂલ રહેતી લકઝરીઓ પ્રવાસીઓ વિના સુની બની છે. વળી કોરોના સંક્રમણ અટકાવવા સ્ટેચ્યુ ઓફ યુનિટી સિમલા, મનાલી, જમ્મુ-કાશ્મીર, કેરાલા, ગોવા, બદ્રીનાથ, કેદારનાથ, તીરૂપતી સહિતના દેશભરમાં આવેલા મુખ્ય પર્યટક અને ધાર્મિક સ્થળો બંધ રાખવાનો નિણય કરવામાં આવતા ટ્રાવેલ્સ ઓપરેટરોની હાલત કફોડી બની છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાંથી ધંધાર્થે તેમજ મજૂરી માટે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને રાજસ્થાન અવરજવર કરતા લોકોની પણ આવજામાં ઘટાડો થતાં અહીંથી દૈનિક આ રૂટ પર દોડતી લકઝરીઓની માંગ ઘટતા પડતા ઉપર પાટા સમાન સ્થિતિ સર્જાઈ છે. પરિણામે કોરોના કાળ દરમિયાન ટ્રાવેલ્સનો ધંધો સાવ ભાંગી પડતા ઉત્તર ગુજરાતમાં દોડતી ૧૦૦૦થી વધુ લકઝરી બસોમાંથી ૭૫ ટકા જેટલી બસોને આરટીઓ ટેક્ષમાંથી છુટકારો મેળવવાના હેતુથી સંચાલકો નોનયુઝ કરવા મજબૂર બન્યા છે.

સામાન્ય દિવસોમાં ઉત્તર ગુજરાતમાં ટ્રાવેલ્સનો વ્યવસાય ખુબજ તેજમાં રહેતો હતો. પરંતુ કોરોનાના આગમનના પગલે હાલ આ ધંધા ઉપર માઠી અસર થઈ છે. ઉનાળાની ઋતુમાં પંચકમાંથી ચાર ધામોની યાત્રા સહિત દેશભરમાં આવેલ પર્યટક સ્થળો અને ધાર્મિક સ્થળોએ જતા લોકોની સંખ્યા

હારીજ ગામમાં બે બહેનપણીઓએ કેનાલમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું

પાટણ

હારીજના ભલાણા ગામ પાસેની કેનાલમાં ઝંપલાવી બે બહેનપણીઓએ જીવન ટૂંકાવી લીધું છે. જેના કારણે બંનેના પરિવારમાં દુખની લાગણી છવાઈ ગઈ છે. ખરીદી કરવા જવાનું કહીને બપોરથી નીકળેલી ટીકરીઓ મોડી સાંજ સુધી પરત ન આવતા પરિવારે શોધખોળ હાથ ધરી હતી. આ અંગે હારીજ પોલીસે સીઆરપીસી ૧૭૪ મુજબ નોંધ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, શંભેશ્વર તાલુકાના સિપર ગામે રહેતા જગદીશભાઈ અજમલભાઈ જાદવ (નાડોદા પટેલ) ની ૨૧ વર્ષની ભત્રીજી સ્નેહલ નનુભાઈ જાદવની અને મુબારકપુરા ગામે રહેતી તેની ૨૩ વર્ષની બહેનપણી જયશ્રી

ગજજભાઈ સિંધવ ગત તા.૦૧-૦૬-૨૦૨૧ને મંગળવારે શંભેશ્વર ખાતે ખરીદી કરવા જવાનું કહીને ઘરમાંથી નીકળ્યા હતા. બંને બહેનપણીઓ મોડે સુધી ઘરે પરત નહીં ફરતા પરિવારજનોએ ચિંતિત થઈને શોધખોળ શરૂ કરી હતી. પરિવારે શોધખોળમાં કરતાં જે હકીકતમાં સામે આવ્યું કે, બંને સહેલીઓએ કોઈ અગમ્ય કારણોસર હારીજના ભલાણા ગામની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં મોતની છલાંગ લગાવીને જીવન ટૂંકાવ્યું છે. આ કરુણ બનાવને પગલે બંનેના પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. આ બનાવ અંગે હારીજ પોલીસે સીઆરપીસી ૧૭૪ મુજબ નોંધ કરી છે. જેની વધુ તપાસ કાર્યવાહી પોસ્ટ એસબી સોલંકી કરી રહ્યા છે.

"Savings For YOU, Protection for Your Loved Ones"

: Offered services :

1. Life Insurance
2. Mortgage Insurance
3. Critical Illness Insurance
4. Visitors Medical Insurance
5. Tax Return Filing
6. Super Visa Travel Insurance

Shailesh Patel

CALL TODAY
Cell : 416 837 9155
Email : shailesp@gmail.com

We represent many insurance companies, we can shop around for best rates.

Imperial PEST CONTROL

Residential • Commercial • Industrial

24 Hour Service • 7 Days a Week

Preventing the Spread of COVID-19 : Our disinfectant services that we offer are:

1 Spray Services	2 Fogging Services	3 Sanitation Services
-------------------------	---------------------------	------------------------------

All Pest Control:

Mouse & Rats, Cockroaches, Bedbugs, Silver Fish, Spiders & Fleas, Carpenter Ants. Total Interior & Exterior Pest Control

Removal:

Bees & Wasps, Pigeon, Squirrels, Raccoon, Skunk, Nest & Hive, Hornests, Yellow Jackets

Free Estimates & Written Guarantee

Special Service For Bedbug Control

First Time Customer gets **10% Off** on your first home service
*Mention this offer while booking

www.imperialpestcontrol.ca
info@imperialpestcontrol.ca
(We speak English, हिन्दी, ગુજરાતી)

Call: Ramesh Kanani 416-837-1820

<p>સ્વદેશ CANADA Registration # 869127209 Publication Mail Agreement / Email : info@swadesh.news</p>	<p>Return Undeliverable Canadian Address To :</p> <p>Shree Balaji Inc. MAILING ADDRESS 23 Lyric Road, Brampton ON L6S 0B4. 416-996-7755</p>	<p>Editor & Publisher : Manoj Gandhi</p> <p>Director : Nilesh Tailor</p> <p>Sub Editor : Chhaya Gandhi</p> <p>Montreal Bureau : Vijay Patel (514-826-7442)</p>	<p>Designed By</p> <p>Sabir Daroga</p> <p>Mevada Piyush</p> <p>Firoz Shaikh</p>
	<p>Registered Address 713, Markham Road, Scarborough M1H 2A8.</p>	<p>GUJARAT OFFICE MAC AGENCIES : F-9, Jolly Square, Ram Chowk, Ghod-Dod Road, Surat – 395 001. GUJARAT (INDIA)</p>	<p>WWW.SWADESH.NEWS</p>



વિશ્વામિત્રીને પુનર્જીવિત કરવાનું ભૂત ફરી ધૂણ્યું: સર્વે પાછળ લાખોનો ધુમાડો કરાશે

વડોદરા

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના હુકમ બાદ વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીનો સેટેલાઈટ ડિજિટલ સર્વે કરવામાં આવનાર છે ત્યારે ફરી એક વખત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિશ્વામિત્રી પુનર્જીવિત કરવાનું ભૂત ધૂણ્યું છે.

વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની સુંદરતા વધે અને તેના શુદ્ધિકરણ માટે અગાઉ ભાજપના પૂર્વ મેયર અને સાંસદ બાળુ શુક્લ દ્વારા પ્રોજેક્ટ તૈયાર થયો હતો જેના ભાગરૂપે વિશ્વામિત્રી નદીમાં બંને બાજુ માટીના પાલા બનાવવા પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો ત્યારબાદ ચોમાસા સમયે તેનું ધોવાણ થઈ ગયું હતું. વડોદરા શહેરની મધ્યમાંથી પસાર



થતી વિશ્વામિત્રી નદીના શુદ્ધિકરણ માટે તેમાં ઠલવાતા ગંદા પાણી અટકાવવા માટે સયાજી બાગ અને છાણી ખાતે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ બનાવવામાં આવ્યા તેમ છતાં આજે પણ વિશ્વામિત્રી નદીમાં કોર્પોરેશન પોતે જ રોજનું લાખો ગેલન ડ્રેનેજનું ગંદુ પાણી ચાલી રહ્યું છે.

નડિયાદમાં બે જૂથ વચ્ચે ભીષણ અથડામણમાં સાંતથી વધુને ઈબ

નડિયાદ

ખેડા જિલ્લાના નડિયાદમાં બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ હતી. એક જ સમાજના બે જૂથ વચ્ચે મારામારી અને પથ્થરમારો કરવામાં આવતાં વાતાવરણમાં તંગદિલી સર્જાઈ હતી. આ ઘટનામાં ૭થી વધુ લોકોને ઈજા પહોંચી હતી. નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી ટેલિફોન ઓફિસ પાસે તળાવની માટીને લઈને બે પિતરાઈ ભાઈઓના કુટુંબ વચ્ચે માથાકૂટ થઈ હતી. એક કોમના બે જૂથ વચ્ચે ભારે પથ્થરમારો અને મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. જેના લીધે તંગદિલી ભર્યું વાતાવરણ

સર્જાયું છે. આ ઘટનામાં ૭થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે જ્યારે ૩થી વધુ વાહનોને નુકસાન પહોંચ્યું છે. તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ઘસેડવામાં આવ્યા છે. એક જ કોમના બે પિતરાઈ ભાઈઓના જૂથો વચ્ચે તળાવની માટીને લઈને માથાકૂટ થતાં મામલો બિચક્યો હતો અને ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ત્યારબાદ ગુસ્સે ભરાયેલા બંને પક્ષના લોકોએ સામસામે પથ્થરમારો કર્યો હતો. ઘટનાની જાણ થતાં નડિયાદ પશ્ચિમ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. અને બંને પક્ષોના નિવેદન લઈ ફરિયાદ નોંધવાની કામગીરી હાથ ધરી છે.

નડિયાદમાં ધોળા દિવસે જ્વેલર્સમાંથી 2 લાખથી વધુના દાગીનાની ચોરી

નડિયાદ

નડિયાદ : નડિયાદ શહેરના ભાવસારવાડ વિસ્તારમાં અજગરઅલી ઉર્ફે રાજુભાઈ શેખ સોના-ચાંદીના દાગીના ઘરેણા બનાવવાનું કામ કરે છે. શનિવારે બપોરે અસગરઅલીના પિતા અકબરઅલીનો ફોન કરી જણાવેલ કે મોટર સાયકલની ચાલી દુકાને આવી આપી જા મારે બહાર જાવુ છુ. જેથી અસગરઅલી મોટર સાયકલની ચાલી આપવા પોતાની દુકાન બંધ કરી તાળુ મારી ચાલી આપવા માટે ગયા હતા. આશરે અડધા કલાક બાદ પરત આવતા દુકાનમાં ચોરી થઈ ગઈ હતી. જે બાદ તપાસ થતાં સોનુ કિ.રૂ.૨,૧૦,૬૦૦ અને ચાંદી કિ.રૂ.૧૦,૦૦૦ ચોરી થઈ હોવાનું માલૂમ પડ્યું હતું.

આણંદના વિદ્યાર્થીઓએ ડિસ્ટન્સ જાળવવામાં મદદરૂપ ટોપી બનાવી

આણંદ

કોરોના કાળમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવું ખુબ જ અગત્યની ભૂમિકા ભજવે છે. ત્યારે ગુજકોસ્ટ સી.સી પટેલ લોક વિજ્ઞાન કેન્દ્રના બાળકો દ્વારા નજીવા ખર્ચે અત્યાધુનિક ટોપી તૈયાર કરવામાં આવી છે.

કોરોના મહામારીની ચેન તોડવા ડિસ્ટન્સ જાળવવું ખુબ જ જરૂરી બન્યું છે. ત્યારે ગુજકોસ્ટ ગુજરાત સરકાર દ્વારા પ્રાયોજિત આણંદ સી.સી.પટેલ લોક વિજ્ઞાન કેન્દ્રના ૩ વિદ્યાર્થીઓએ ધોરણ ૭ માં અભ્યાસ કરતી એક બાળકીની મદદ માટે એક ટોપી બનાવી છે. ટોપી પહેરનાર

વ્યક્તિના આગળ તેમજ ડાબી અને જમણી બાજુ 60 સેન્ટીમીટરથી નજીક કોઈ પણ આવે તો આ ટોપીમાં લાગેલું સેન્સર તેને ડિટેક્ટ કરી ટોપીમાં લાગેલું બજર વાગવા લાગે છે જેથી ટોપી પહેરનાર વ્યક્તિને સોશિયલ ડિસ્ટન્સ જાળવવામાં સરળતા રહે છે અને કોરોના વાયરસ જેવી મહામારીથી લોકો પોતાને સુરક્ષિત રાખી શકે છે. કોરોના બાદ જ્યારે પ્રથમ વખત સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ માટે બાળકોને કેલવામાં આવ્યું ત્યારે બાળકોને પોતાના હાથ મોઢાથી નજીક નહીં લઈ જવા અથવા મોઢા પર અડવાથી રોકવાનો શિક્ષકો પ્રત્યન કરી રહ્યા હતા.

નડિયાદના ઝારોલ ગામે જમીન મુદ્દે 4 સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો

નડિયાદ

નડિયાદ વલ્લભનગરમાં રહેતા રેખાબેન રાજેશભાઈ પ્રજાપતિએ નડિયાદ તાલુકાના ઝારોલ ગામની સિમ નં-૨૨૮ જમીન રાખી હતી. આ જમીનના વારસદારો તરીકે ખોડાભાઈ મોહનભાઈ,રમણભાઈ ગાંડાભાઈ અને અન્ય છ વ્યક્તિઓના નામ હતા. જમીન પસંદ આવતા જમીનની કિંમત નક્કી કરાઈ હતી. અને થોડી રકમ બાકી રખાઈ હતી. જોકે ત્યારબાદ વેચાણ રાખેલ જમીન પર જતાં ત્યારે ખોડાભાઈ, રમણભાઈ, મનુભાઈ, દશરથભાઈએ ફરિયાદીઓને જમીન પર જવા દીધા ન હતા આ બાબતે વસો પોલીસ મથકે તપાસ કરતા ફરજ પરના અધિકારીએ જણાવ્યું હતું કે હજી હમણાં કેસ નોંધાયો છે.

ખેડામાં નોકરીના બોગસ ઓર્ડર આપી 53ને છેતરનાર ચાર ગઠિયા પકડાયા

સરકારી નોકરી અપાવવાના બહાને ખોટા સહી સિક્કા કરી આપ્યા

મોડાસા : ભિલોડા તાલુકાના ખારી ગામના એક યુવકને છેતરી સરકારી નોકરીનો બોગસ ઓર્ડર આપી રૂપિયા ૧ લાખ અને અન્ય ૪ ઉમેદવારો પાસે થી રૂપિયા ૨ લાખ મળી કુલ ૩ લાખ તકડાવી ખોટા સહી-સીકકા વાળા સરકારી નોકરીનો ઓર્ડર અપાતાં આ ગઠિયાઓ વિરૂધ્ધ શામળાજી પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો હતો.

આ ચક્રચારી પ્રકરણની તપાસ જિલ્લા એસઓજી પોલીસને અપાતાં આ ટીમે ઈલેક્ટ્રોનિક ટેકનીકલ સોર્સ થકી તપાસ હાથ ધરી જુદીજુદી ટીમો રચી આ ચારેય ગઠિયાઓને ઝડપી લેતાં ખોટાખોટા સરકારી નોકરી આપવાનું આખું રેકૅટ ઝડપી પડાયું હતું. અને આ ગઠિયાઓએ આજદીન

સુધીમાં અરવલ્લી,સાબરકાંઠા સહિતના ૬ જિલ્લાના કુલ ૫૩ ઉમેદવારો પાસે થી રૂપિયા ૫૮.૮૦ લાખ પડાવી છેતરપીંડી આચરી હોવાનું ખુલ્યું હતું. રાજ્યમાં બેરોજગારી વકરી છે, ત્યારે હર કોઈને સરકારી નોકરી મેળવવાની ઈચ્છા જોવા મળી રહે છે, સરકારી નોકરી મેળવવા બેરોજગાર ઉમેદવારો કંઈપણ કરવા તૈયાર થઈ જતાં જોવા મળે છે. આવી જ સરકારી નોકરી ની ઈચ્છા ધરાવતા ભિલોડા તાલુકાના ખારી સહિત ગામોના પાંચ જણા ગઠિયાઓની વાતમાં આવી છેતરાયા હતા. અને રૂ.૩ લાખ તકડાવી નોકરીના બોગસ ઓર્ડર પધરાવી દેવાતાં આ પ્રકરણે ૪ આરોપીઓ વિરૂધ્ધ શામળાજી પોલીસ સ્ટેશને નામજોગ ફરીયાદ નોંધાઈ હતી.

ખેડા જિલ્લામાં નહેરમાં રૂબી જતા 2 દિવસમાં 4 યુવાનોના મોતથી ચક્રચાર

ઠાસરા તાલુકાના પીપલવાડાના બે યુવાનોએ શેઠી શાખા નહેરમાં જીવ ગુમાવ્યો

નડિયાદ : ખેડા જિલ્લામાં છેલ્લા અડતાલીસ કલાકમાં બે અલગ અલગ જગ્યાઓ પર અપમૃત્યુના બે બનાવોમાં ચાર વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો છે. ઠાસરા તાલુકાના પીપલવાડા ગામના બે યુવાનો શેઠી શાખા નહેરમાં ન્હાવા પડતા મૃત્યુ પામ્યા છે. જ્યારે મહેમદાવાદ તાલુકાના ઘોડાસર ગામ નજીકથી પસાર થતી કેનાલમાં રવિવારના રોજ બે યુવકો ન્હાવા પડ્યા હતા. જેમાં એક યુવકની લાશ ગઈકાલે મોડી રાતે મળી આવી હતી. જ્યારે બીજા યુવકની લાશ આજે બપોરે નડિયાદ ફાયરબ્રિગેડની ટીમે શોધી કાઢી છે.

ઠાસરા તાલુકાના પીપલવાડા ગામના પેટા

ગામ દાજીપૂરાના બાબુભાઈ રાઠોડ ઉ.૩૩ અને રવંતસીંહ રાઠોડ અન્ય ત્રણ મિત્રો સાથે ઠાસરા કામ અર્થે ગયા હતા. અડધા કલાકમાં ઠાસરામાં કામ પૂર્ણ કરી પાંચેય વ્યક્તિઓ રીક્ષામાં ઘર તરફ આવી રહ્યા હતા. તે સમયે ઠાસરાથી અડધા કિ.મીના અંતરે આવેલ શેઠીશાખા નહેરના પુલ પાસે રીક્ષા ઉભી રાખી હતી.પાંચેય વ્યક્તિઓમાં બાબુભાઈ અને નરવંતસિંહ પાળ પર કપડા અને ચંપલ કાઢી નહેરમાં ન્હાવા ઉતરતા પાળ ઉપરની લીલ કારણે પગ લપસી જતાં બંને યુવકો નહેરના પાણીમાં ગરકાવ થયા હતા. જ્યારે અન્ય ત્રણ યુવકો રીક્ષા લઈને બનાવ સ્થળેથી જતા રહ્યા હતા.



First Flight
FFCL Couriers Inc.

દુનિયાના કોઈપણ દેશમાં ડોક્યુમેન્ટ્સ અને પાર્સલ મોકલવા માટે પણ સેવા ઉપલબ્ધ


તમારા ડોક્યુમેન્ટ્સ અને પાર્સલ ઈન્ડિયા મોકલવા માટે સૌથી વ્યાજબી ભાવ અને સર્વશ્રેષ્ઠ સ્થળ

<p>1 LB \$20 વધુ દર LB ના \$5</p> <p>11 LB \$50 વધુ દર LB ના \$5</p> <p>23 KG \$165, વધુ દર KG ના \$10</p> <p>30 KG \$210, વધુ દર KG ના \$10</p>	<p>ખાવા-પીવાની વસ્તુ USA મોકલવા માટે FDA ની એપ્રુવલ અમે કરી આપીશું (Extra Charge)</p>	
--	--	--

જીટીએની સૌથી મોટી ઈન્ડિયન કુરિયર કંપની હવે તમારી સેવા માટે ચાર શાખાઓ

Brampton (West)	Scarborough	Mississauga
<p>519, Ray lawson boulevard , Unit-3, Brampton ON L6Y 0N2 Chandni Chowk Plaza, Opposite Vegetables Market. Phone 647-761-1317, 647-657-9631 -----: MON-FRI : ----- 2.00 PM to 6.00 PM : SAT-SUN : 1.00 PM to 6.00 PM</p>	<p>WE ARE RE-OPENING 880 Markham Road, Unit-8 Main Intersection Markham Road & Painted Post, Near Saileela Khaman-Dhokla House Complex, Phone 647-657-9631 905 673 9631 -----: MON-TUE : ----- 2.00 PM to 6.00 PM : SAT-SUN : 11.00 AM to 6.00 PM</p>	<p>2960 Drew Road, Unit-158, Mississauga ON L4T 045 Great Punjab Plaza, Near Malton Gurudwara. : Phone : 905-673-9631 905-231-0527 647-657-9631 -----: MON-FRI : ----- 11.00 AM to 5.00 PM</p>

૬૪૭-૭૬૧-૧૩૧૭ www.firstflightcanada.com



પત્નીને મારપીટ કરવાના કેસમાં કરણ મહેરાની ધરપકડ

મુંબઈ: કરણ મહેરાની પત્ની નિશા સાથે મારપીટ કરવાના આરોપસર મુંબઈ પોલીસે ધરપકડ કરી છે. ગોરગાંવ પોલીસ મથકમાં કરણ મહેરાનુ નિવેદન લેવામાં આવ્યા બાદ પોલીસે તેને જામીન પર મુક્ત કર્યો હતો. નિશા રાવલ પણ ટીવી એક્ટ્રેસ છે. અભિનેતા કરણ મહેરા ટીવી પરના ચે રિશ્તા ક્યા કહેલાતા હૈ...ના કારણે ઘરે ઘરે લોકપ્રિય થયો હતો. કરણ અને નિશા વચ્ચે થયેલી બોલાચાલી બાદ નિશાએ પોલીસ મથકમાં કરણ પર મારપીટ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો.



સ્વદેશ

09

Web : www.swadesh.news | E-mail : info@swadesh.news

FRIDAY, 04 JUNE, 2021

ઈન્ડિયન આઇડલ વિવાદ વકર્યો, સુનિધિ ચૌહાણે આરોપ લગાવ્યા



ઈન્ડિયન આઇડલ એક એવો રિયાલીટી શો જે નવા કલાકારોને પ્લેટફોર્મ પુર પાડે છે. હાલ આ શો એક પછી એક વિવાદોના કારણે સતત ચર્ચામાં છે. કિશોર કુમારના પુત્ર અમિત કુમારનો એપિસોડ અંગે શરૂ થયેલો વિવાદ હજી પણ ચાલુ છે. કિશોર કુમારના પુત્ર અમિત કુમારે કહ્યું હતું કે તેમને તમામ સ્પર્ધકોની પ્રશંસા કરવાનું કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ આ વિવાદમાં સુનિધિ ચૌહાણ ખેડાઈ હતી સુનિધિ ચૌહાણે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે તેમને શોના સ્પર્ધકોની પ્રશંસા કરવાનું કહેવામાં આવ્યું હતું. તે કહે છે, 'દેરેકના વખાણ કરવા મારા વશનું નથી આથી મે આ શો છોડી દીધો હતો. સુનિધિ ચૌહાણ ઈન્ડિયન આઇડલની સીઝન 5 અને 6 માં જજ તરીકે રહી હતી. આ મામલે આદિત્ય નારાયણ એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે ના આ વાત તદ્દન ખોટી છે. આવું ક્યારેય કરવામાં આવતું નથી શોના તમામ જજને પુરતી છુટ હોય છે કે તેઓ પોતાનો નિર્ણય જણાવી શકે અહીં આવું કોઈ પ્રેસર હોતું નથી. જે લોકો શો અંગે કહી રહ્યા છે તેઓ કોઈને કોઈ વાતથી વિવાદ ઉભો કરવા માગે છે.

કાજલ અગ્રવાલે પોતાની ફી અડધો અડધ ઘટાડી દીધી

લગ્ન પછી તેને ફિલ્મોમાં કામ મળવાનું મુશ્કેલ થતા ભરેલું પગલું

મુંબઈ : બોલીવૂડ અને ટોલીવૂડ અભિનેત્રી કાજલ અગ્રવાલે ગયા વરસે બિઝનેસમેન ગૌતમ કિચલુ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછી તે પોતાનું પરિણીત જીવન એન્જોય કરી રહી હતી. પરંતુ સાથેસાથે તેને કારકિર્દીની ચિંતા પણ થઈ રહી છે. ટોલીવૂડમાં ટોચ પર રહેલી આ અભિનેત્રીને હવે કામ નથી મળી રહ્યું પરિણામે તે મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શરૂઆતથી જ આ પ્રથા ચાલી આવી છે કે, લગ્ન પછી અભિનેત્રીઓને કામ મળવાનું બંધ અથવા તો ઓછું થઈ જતું હોય છે. કાજલ પણ આવી જ મુશ્કેલીનો સામનો કરી રહી છે. હવે તેના માટે એવા દિવસો આવી ગયા છે કે એક મનપસંદ ફિલ્મમાં કામ કરવા માટે તેણે પોતાની ફીમાં અડધો અડધ ઘટાડો કરી દીધો છે. તેણે આ ઓફર હાથમાંથી જતી ન રહે એ ડરથી આ નિર્ણય લીધો છે. જોકે તેના માટે આવો કપરો નિર્ણય લેવાનું સરળ નહોતું. તેના વર્કફ્રન્ટની વાત કરીએ તો, કાજલ ચિરંજીવી સ્ટારર ફિલ્મ આચાર્યામાં લીડ રોલમાં જોવા મળવાની છે. આ ફિલ્મમાં તેની સાથે પૂજા હેગડે પણ કામ કરી રહી છે. એટલું જ નહીં કાજલ કમલ હાસનની ઈન્ડિયન ટુમાં પણ જોવા મળવાની છે.



અભિનેત્રી જુહી ચાવલાએ 5G વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી

ભારતમાં 5G ટેકનોલોજી માટેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ દરમિયાન આ ટેકનોલોજીને લઈને પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. એવી વાતો પણ સાંભળવા મળી હતી કે ભારતમાં 5G પરીક્ષણને કારણે લોકો મરી રહ્યા છે અથવા 5G ટાવર લગાવવાથી રેડિએશન ઝડપથી ફેલાશે અને તેનાથી માણસો અને પ્રાણીઓ સહિતના જીવો પર ખરાબ અસર થશે. ત્યારે હવે આ કારણને લઈને જાણીતી અભિનેત્રી જુહી ચાવલાએ આ અંગે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે. જાણીતી અભિનેત્રી જુહી ચાવલા લાંબા



સમયથી મોબાઈલ ટાવર્સમાંથી નીકળતાં નુકસાનકારક રેડિએશન સામે લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસ કરી રહી છે. આ અંગે હવે તેણે કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. જેની સુનાવણી થઈ ચુકી છે. આ અરજીમાં જુહી ચાવલાએ ભારત સરકારના ટેલિકોમ મંત્રાલયને 5G ટેકનોલોજીના અમલીકરણથી લોકો, પ્રાણીઓ, વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ પર પડતા પ્રભાવનું બારીકાઈથી અભ્યાસ કરવા જણાવ્યું હતું અને આના રીપોર્ટના આધારે ભારતમાં અમલ કરવા અને ન કરવા અંગે નિર્ણય લેવાની માંગ કરી છે

PayLessTravel
Fly Well ... Pay Less

વિમાની સેવાના ભુકીંગ માટે એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ

Call for all your Air Travel Services

- Lowest Prices for Ahmedabad, Vadodara, Mumbai, Delhi
- We will beat or match any online price with better service, call once before booking online
- Best Service
- We sell Travel Insurance

Call us for the Lowest Fares Coming From India to Canada Also

Please Call 905-281-2627

Address : 100 Matheson Blvd. East, Unit-203, Mississauga, ON. L4Z 2G7

Get Updated travel information during COVID time

Tico # 50015262
tico.ca
Travel Industry Council of Ontario

GRAND CENTRAL MIMICO
(South Tower)

Guaranteed Access to this prestigious project.

Located at Royal York Rd & Evans Ave in Etobicoke! Grand Central Mimico will feature direct access to the Mimico GO Station,

Starting from **\$500's**

Nadir Shah MBA
Sales Representative

416.625.3580
nadir.shah@sympatico.ca

CENTURY 21
Regal Realty Inc. Brokerage
Member Broker

4030, Sheppard Ave. East, Toronto,
ON M1S 1S6 T: 416.291.0929 (24/7)
F: 416.291.0984

Not Intended to solicit buyers or sellers already under a contract



॥ संस्कृति ॥



હવે, સ્વદેશ વેબસાઈટના બદલાતા કલેવર

નિહાળો નીત નવા રૂપરંગમાં !!

માત્ર ગરવી ગુજરાત કે મેરા ભારત મહાન જ નહિ પરંતુ સમગ્ર વિશ્વની અટારીએ સર્જાતી અનેકવિધ ઘટનાઓનો સાક્ષાત્કાર ક્ષણેક્ષણ માણો !!

રાજકારણ, સમાજ, ધર્મ, શિક્ષણ, રમતગમત, મનોરંજનનો મહાસાગર, હોલીવુડ-બોલીવુડ, પ્રવાસ-પર્યટન, પર્યાવરણ તથા આરોગ્ય વિષયક માહિતીના રોમાંચક ખજાનાનો આવિષ્કાર !!

www.swadesh.news

સ્વદેશમાં વિજ્ઞાપનો માટે ઈમેલ એડ્રેસ પર માહિતી મોકલો

info@swadesh.news

હવે પછી નીચે મુજબના સરનામે તમામ પોસ્ટલ વ્યવહાર કરવા વિનંતી.

23 Lyric Road, Brampton ON L6S 0B4.

વાઈરસને વૃદ્ધિ પામતો અટકાવતી કોકટેલ બનાવ્યાનો સ્વિસ ફાર્માસ્યુટિકલ કંપનીનો દાવો

કોરોના સામે નવું હથિયાર એન્ટિબોડી કોકટેલ

૨૦૨૦થી સમગ્ર દુનિયામાં તરખાટ મચાવનાર કોરોનાને કારણે મોટાભાગના દેશની હાલત કફોડી થઈ ચુકી છે. હજી પણ દરરોજ કોરોના સંક્રમણના આંકડા બહાર આવી રહ્યા છે. દરેક દેશમાં હવે આરોગ્ય સેવા બોજ બની રહી છે. કોરોનાની શરૂઆત થઈ તે સમયે યુએસમાં ટ્રમ્પની સરકાર હતી. ટ્રમ્પે આ બાબતને ગંભીરતાથી ન લેતાં ખુદ મહાસત્તા પણ વાયરસ સામે ઘુટણીયે પડી ગયું હતું. તે સમયે તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ માસ્ક વિના ફરતાં દેખાયાં હતાં. ટ્રમ્પના સમર્થકોએ પણ માસ્કનો વિરોધ કરી રહ્યાં હતાં. પરંતુ તે પછી ૨૦૨૦ના ઓક્ટોબર મહિનામાં જ ડોનાલ્ડ ટ્રમ્પ પોતે કોરોનાગ્રસ્ત થઈ ગયાં હતાં. જો કે, થોડાં દિવસોમાં જ ટ્રમ્પ સ્વસ્થ થઈ વિશ્વની સામે આવ્યાં હતાં. આ સમયે ટ્રમ્પે જાહેર કર્યું હતું કે, પોતે એન્ટિબોડીઝનું એટલું મજબૂત કોકટેલ લીધું કે કોરોના ભાગી ગયો! દુનિયા માટે આ અચરજની વાત હતી. તે પછી આ વિશે ઘણી ચર્ચા થઈ હતી.

હવે સ્વિસ ફાર્માસ્યુટિકલ કંપની રોશેની આ એન્ટિબોડી કોકટેલને ભારતમાં પણ ઈમરજન્સી ટ્રાયલ માટે મંજૂરી આપી દેવાઈ છે. આ એન્ટિબોડી કોકટેલ ખરેખર છે શું? અને તે કોરોના દર્દીઓને કેવી રીતે મદદ કરે છે? તેને સમજવું જરૂરી છે. ભારતની સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ્સ કંટ્રોલ ઓર્ગનાઈઝેશને સ્વિસ ફાર્માસ્યુટિકલ કંપની રોશે દ્વારા બનાવાયેલી દવા એન્ટિબોડી કોકટેલને ઈમર્જન્સી ઉપયોગની મંજૂરી આપી છે. આ દવા કોરોનાના દર્દીઓની સારવારમાં ખુબ જ ઉપયોગી સાબિત થઈ રહી હોવાનો દાવો કરાયો છે. તે એક ખાસ પ્રકારની એન્ટિબોડી કોકટેલ અથવા બે એન્ટિબોડીઝનું મિશ્રણ હોવાનું કહેવાય છે. અમેરિકામાં તેને રેજેનરન કોકટેલ કહેવાતું હતું, કારણ કે તે કંપની રેજેનરન ફાર્માસ્યુટિકલ્સ દ્વારા બનાવવામાં આવ્યું હતું. તેને તપાસની દવા તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે. મતલબ કે, અમેરિકન ફૂડ એન્ડ ડ્રગ્ એડમિનિસ્ટ્રેશન દ્વારા આ ડ્રગ્નું કેમિકલ લેબમાં સુરક્ષિત મળી આવ્યું છે. જો કે, તેમની ક્લિનિકલ ટ્રાયલ્સ હજી બાકી છે.

માનવ શરીરમાં આ એન્ટિબોડીઝ કોકટેલ કેવી રીતે કામ કરે છે? તેને વિસ્તારથી સમજવું જોઈએ. શરીરમાં કોઈ વાયરસ અથવા બેક્ટેરિયા આવે છે, ત્યારે તે નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે છે. આ સમયે કેટલાંક પ્રોટીન શરીરની અંદર ઉત્પન્ન થાય છે. જે વાય આકારનું કદ ધરાવે છે. આ પ્રોટીન વાયરસ અને બેક્ટેરિયાના પ્રભાવોને ઘટાડવા લડે છે. આ પ્રોટીનને એન્ટિબોડી અથવા



ઈમ્યુનોગ્લોબ્યુલિન તરીકે ઓળખવામાં આવે છે. આવાં એન્ટિબોડી સ્વિસ કંપની દ્વારા લેબમાં બનાવાયા છે. લેબમાં બનેલાં આ એન્ટિબોડીઝ માનવ શરીરમાં દાખલ થતાં વાયરસ વિરુદ્ધ લડે છે. કેસિરીવિમેબ અને ઈમ્બેવિમેબ નામના એન્ટિબોડીઝનું આ કોકટેલ છે, જે ખાસ કરીને કોરોના વાયરસના સ્પાઈક પ્રોટીન ઉપર હુમલો કરે છે. તે જ સ્પાઈક પ્રોટીન જે કોરોના વાયરસ પર કાંટા જેવા દેખાય છે. આના દ્વારા જ વાયરસ માનવ કોષોને વળગી રહે છે. આ એન્ટિબોડી આ સ્પાઈકને ચોંટતાં અટકાવે છે. રોશે કંપનીએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, એન્ટિબોડીઝ ખાસ કાળજી રાખી સંશોધનો પછી બનાવાઈ છે. આ કોકટેલની મદદથી તે વાયરસની અસરને ઘટાડે છે અને ચેપને નિયંત્રિત

**પ્રાસંગિક
ધવલ શુક્લ**

બાળકોને પણ આપી શકાય છે. આ દવા એવાં દર્દીઓને આપવાની ભલામણ કરવામાં આવી છે, જેમાં કોરોનાના ગંભીર ચેપનું જોખમ છે. જેમાં ૬૦ વર્ષથી વધુ ઉંમરના લોકો અને જેઓ પહેલાથી ડાયાબિટીઝ, કિડની-ફેફસાના રોગ, બીપી અથવા હૃદય સંબંધિત રોગોથી પીડિત છે તેવાં દર્દીઓને તે આપી શકાય છે.

બે એન્ટિબોડી કેસિરીવિમેબ અને ઈમ્બેવિમેબ કોરોના વાયરસને કોષ સાથે બાઈન્ડ થતો અટકાવી તેના સ્પાઈક પ્રોટીનને નિષ્ક્રિય કરી દે છે. ગંભીર ચેપના જોખમવાળા દર્દીઓને લાભ થશે

કરે છે. જો કે, કંપનીએ એવી સ્પષ્ટતા પણ કરી છે કે, એન્ટિબોડીઝનું આ કોકટેલ બધા કોરોના દર્દીઓ માટે નથી. પ્રારંભિક લક્ષણો દેખાયાં હોય તેવાં કોરોનાના ઓછા અથવા મધ્યમ લક્ષણો ધરાવતાં કોરોના દર્દીઓને પહેલાં ૧૦ દિવસમાં આપી શકાય છે. આ કોકટેલ પુખ્ત વયના દર્દીઓ ઉપરાંત ૧૨ વર્ષ અથવા તેથી વધુ ઉંમરના

બાળકોને પણ આપી શકાય છે. આ દવા એવાં દર્દીઓને આપવાની ભલામણ કરવામાં આવી છે, જેમાં કોરોનાના ગંભીર ચેપનું જોખમ છે. જેમાં ૬૦ વર્ષથી વધુ ઉંમરના લોકો અને જેઓ પહેલાથી ડાયાબિટીઝ, કિડની-ફેફસાના રોગ, બીપી અથવા હૃદય સંબંધિત રોગોથી પીડિત છે તેવાં દર્દીઓને તે આપી શકાય છે. ૧૨૦૦ મિલિગ્રામની માત્રામાં એટલે કે, ૬૦૦ મિલિગ્રામ કેસિરીવિમેબ અને ૬૦૦ મિલિગ્રામ ઈમ્બેવિમેબને ભેળવીને ઈન્જેક્શન દ્વારા શરીરમાં પહોંચાડવામાં આવે છે. કંપનીના સીઈઓ વી. સિમ્પસન ઈમેન્યુએલે કરેલા દાવા પ્રમાણે રસી જે રીતે શરીરમાં એન્ટિબોડી બનાવે છે અને પછી તે વાઈરસ સામે લડે છે, તેવી જ રીતે આ દવા પણ એન્ટિબોડી છે. લેબમાં તૈયાર કરાયેલા

વધતું નથી અને દર્દીના જીવને જોખમ ઊભું થતું નથી. ક્લિનિકલ ટ્રાયલમાં આ ચેરપી ૭૦ ટકા અસરકારક પુરવાર થઈ છે. દિલ્હીમાં ખાનગી હોસ્પિટલોમાં આ દવાનો ઉપયોગ શરૂ થઈ ચૂક્યો છે. જો કે કંપનીનું કહેવું છે કે ખાનગી-સરકારી કોવિડ ડેલિવરી હોસ્પિટલમાં પણ આ દવા ઉપલબ્ધ કરાવવામાં આવશે. જો કે, હોસ્પિટલમાં દાખલ કોરોનાના ગંભીર દર્દીઓને આ દવા આપી શકાતી નથી. ભારતમાં મંજૂરી અપાયા બાદ હરિયાણાના એક ૮૪ વર્ષીય દર્દીને આ રસી અપાઈ છે. ગુરુગ્રામમાં આવેલી મેદાંતા હોસ્પિટલમાં દાખલ દર્દીને રસી અપાયા બાદ રજા અપાઈ છે. રોશે ઈન્ડિયાના સીઈઓ વી.સિમ્પસન ઈમેન્યુએલે અનુસાર આ દવાને એન્ટિબોડી કોકટેલ કહેવામાં આવે છે. કોરોના વાઈરસ સામે આ એક નવી ચેરપી ડ્રગ છે. તેમાં કેસિરીવિમેબ અને ઈમ્બેવિમેબ એન્ટિબોડીઝનું કોકટેલ હોય છે. એક પેકેટમાં આ દવા ઈન્જેક્શનની વાયરલ સ્વરૂપે આવે છે. તેને સિપ્લા કંપનીના માધ્યમથી બજારમાં વેચવામાં આવી રહ્યું છે.

જેના એક પેકેટમાંથી બે દર્દીની સારવાર થઈ શકે છે. જો કે, દવા માત્ર ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શનના આધારે જ મળશે. તેનો ઉપયોગ કોરોનાના ઓછા અને મધ્યમ લક્ષણોવાળા એવાં કોરોના દર્દીઓ માટે થાય છે, જે ઉચ્ચ જોખમ વર્ગમાં છે, વૃદ્ધ અથવા પહેલાથી જ કોઈ રોગથી ગ્રસ્ત છે. આ અંગે ભારતના કેટલાક ડોક્ટર કહે છે કે, શરૂઆતના તબક્કામાં જો દર્દીના શરીરમાં એન્ટિબોડી દાખલ કરવામાં આવે તો તે વાઈરસને કોષમાં દાખલ થતો અટકાવી દે છે. તે કોવિડ સામે કારગત છે અને કોવિડના વેરિયન્ટ ૧.૬૧૭ સામે પણ અસરકારક છે. આ એક નવું હથિયાર છે.

આ દરમિયાન સૌથી વધુ ચર્ચા આ દવાની કિંમતની પણ થઈ રહી છે. કારણ કે દવાની કિંમત ૧,૨૦ લાખ રૂપિયા છે. જે ઘણી મોંઘી છે. જો કે, કંપનીનું કહેવું છે કે આ દવાને લીધે વ્યક્તિને કોસ્પિટલમાં દાખલ થવાની શક્યતા ૭૦ ટકા ઘટી જાય છે અથવા મૃત્યુનું જોખમ ઘટી જાય છે. વળી જો હોસ્પિટલમાં હોય તો રિકવરી પણ જલદી આવી જાય છે. આથી વ્યક્તિનો હોસ્પિટલનો જે ખર્ચ થાય છે તેમાં ઘટાડો થશે, આથી આટલી કિંમત તેને અનુસંધાને પરવડી જશે. ઉપરાંત કંપનીનું એવું પણ કહેવું છે કે, જો સરકાર જીએસટી અને કર્સ્ટમ ડ્યૂટી સહિતના કરમાં રાહત આપે તો કિંમત હજુ ઘટી શકે છે. જોકે, હજુ સુધી ગુજરાતમાં કે અન્ય રાજ્યોમાં આ દવાનો ઉપયોગ હજી શરૂ કરાયો નથી.



SHARP
INTERNATIONAL
IMMIGRATION SERVICES



CANADA IMMIGRATION

GOOD NEWS FOR RECENTLY GRADUATED STUDENTS INSIDE CANADA

**STUDENTS UNDER POST GRADUATION WORK
PERMIT WITH IELTS 5 BAND CAN QUALIFIED
TO APPLY FOR PERMANENT RESIDENCY
RIGHT AWAY !!**

Effective May 6, 2021, Immigration, Refugees and Citizenship Canada (IRCC) will begin accepting applications under the following 3 streams:

20,000

applications
for temporary
workers in
health care

30,000

applications for
temporary
workers in other
selected essential
occupations

40,000

applications for
international
students who
graduated from a
Canadian
institution

**FIRST COME FIRST
SERVE BASIS !!**

CONTACT US IMMEDIATELY

**SUPER VISA INSURANCE / TRAVEL INSURANCE
/ PR 90 DAYS INSURANCE**

94- 499 MAIN STREET SOUTH, SHOPPERS
WORLD MALL, BRAMPTON, ONT

**416-745-2466
905-230-7855**

2/A WAGHESHWARI SOC,
VADODARA GUJARAT INDIA

**91-9428973911
91-9512157817**

Email.: info@siis.ca

Website.: www.siis.ca



AMI MEHTA
IMMIGRATION PRACTITIONER

**BUSINESS IMMIGRATION
TO CANADA REQUIRES
3 CR NET WORTH/
1.5 CR INVESTMENT/
BUSINESS OWNERSHIP/
MANAGEMENT EXP**

**REJECTED
CASES WELCOME**

**ONLINE IELTS
SPOKEN ENGLISH
CLASSES ON ZOOM**



ત્વચાની તકલીફ દૂર કરતું એલોવેરા

એલોવેરા ત્વચા માટે ફાયદાકારક છે. ત્વચાની અનેક સમસ્યાઓનો સારો કુદરતી ઉપાય તેમજ ત્વચાને પોષણ પુરુ પાડે છે. વધતી વયના લક્ષણ મહિલાઓમાં અકાળે જોવા મળતા હોય તો એલોવેરાનો ઉપયોગ શરૂ કરવાથી ફાયદો થાય છે. એલોવેરાના વપરાશ કરતી વખતે ડોક્ટરની સલાહ અવશ્ય લેવી. તેમજ પહેલા એલોવેરાની હાથ પર ટેસ્ટ કરી લેવો.



મોઈશ્વરાઈઝ

એલોવેરા ત્વચાને પોષણ આપવાનું કામ કરે છે. તે એક બહુ સારુ મોઈશ્વરાઈઝર છે. કોઈ પણ પ્રકારની ત્વચા માટે તેનો ઉપયોગ કરી શકાય છે. એલોવેરાને મોઈશ્વરાઈઝરની માફક ઉપયોગ કરવા માટે રાતના સૂતા પહેલા એલોવેરાના પાનનો રસ કાઢી લેવો અને હળવા હાથે આ રસથી ત્વચા પર માલિસ કરવું નિયમિત કરવાથી ત્વચા મુલાયમ રહેશે.

કરચલી

એલોવેરામાં એન્ટી ઓક્સિડન્ટ્સની ભરપુર માત્રા સમાયેલી હોય છે. તે ત્વચા પરની કરચલીઓને સાફ કરવાનું કામ કરે છે. તે એક કુદરતી ઉત્તમ એન્ટિ એજિંગ પ્રોડક્ટ છે. વધતી વયનો પ્રભાવ ઓછો કરવા માટે એલોવેરાનો રસ કાઢી તેમાં જૈતૂનનું તેલ ભેળવી ચહેરા પર માસ્કની માફક લગાડવું. 30 મિનીટ પછી ચહેરો ધોઈ નાખવો.

ગર્ભાવસ્થા દરમિયાન

ગર્ભાવસ્થા દરમિયાન પેટ પર સ્ક્રેચ માર્ક્સ પડી જતા હોય છે તેને આછા કરવા માટે એલોવેરાના રસમાં થોડું ગુલાબજળ ભેળવી હળવા હાથે સ્ક્રેચ માર્ક્સ પર લગાડવું. ૧૫-૨૦ મિનીટ પછી ધોઈ નાખવું. આ નુસખો નિયમિત કરવાથી સ્ક્રેચ માર્ક્સ દૂર થાય છે.

ખીલમાં ઉપયોગી

એલોવેરામાં એન્ટી માઈક્રોબિયલ ગુણ સમાયેલા છે. જે ખીલને દૂર કરવામાં ઉપયોગી છે. ખીલ પર બેક્ટેરિયા અને ફંગલ ઇન્ફેક્શનની તકલીફ નહીં હોય તો આ ઉપાય કારગર નીવડે છે.

સુંદરતાના નિખાર

એલોવેરા એક ઉત્તમ સ્કિલેન્ડરનું કામકરે છે. તે ત્વચાના ઉપલા પડમાં રહેલી ગંદકી અને મૃત ત્વચાને બહાર કાઢે છે. જેથી ત્વચા સ્વચ્છ લાગે છે. એલોવેરા જેલ ન હોય તો એલોવેરાની એક ઠાંડી લઈ તેને વચમાંથી કાપી તેના ગરનો ઉપયોગ કરવો.

સનબર્ન દૂર કરે છે

સૂર્યના આકરા કિરણોએ ત્વચાને બાળી નાખી હોય તો તેનાથી રાહત પામવા માટે એલોવેરાના પાનનો રસ રાટીને ચહેરા પર લગાડવો. સુકાઈ જાય પછી ચહેરાને તાજા પાણીથી ધોવો. તેમાં લીંબુનો થોડો રસ પણ ભેળવી શકાય છે. નિયમિત કરવાથી ત્વચા મુલાયમ બને છે.

એમેઝોન ડિવાઈસ તમારું WiFi તમારા પડોશી સાથે શેર કરશે



રોજબરોજ આપને સ્માર્ટ ડિવાઈસ સાથે સંકળાયેલા હોઈએ છીએ. સ્માર્ટ ડિવાઈસ આપણા જીવનનો અવિભાજ્ય અંગ છે. જેમાં મોબાઈલ, લેપટોપ, IoT ડિવાઈસ વગેરેનો સમાવેશ થાય છે. એમેઝોન પણ ઘણા IoT ડિવાઈસ બનાવે છે. જેમાં Alexa, Echo, વિડીઓ ડોરબેલ, સ્માર્ટ કેમેરા તથા અન્ય સેન્સર્સ નો સમાવેશ થાય છે.

8 જુનથી એમેઝોન પોતાના ડિવાઈસમાં એક અપડેટ લાવી રહ્યું છે જેમાં આપમેળે સ્માર્ટ ડિવાઈસ સાથે કનેક્ટેડ બ્રોડબેન્ડ ઇન્ટરનેટ બેન્ડવિડ્થનો એક નાનો ભાગ નજીકના પડોશીઓ સાથે શેર કરશે પરંતુ આ સેટિંગ્સ તમે ઓફ પણ કરી શકશો. તેના માટે કંપની યુ.એસ. માં બધા એક્ટીવ ડિવાઈસને રજિસ્ટર કરવાનું ઈચ્છે છે જે Sidewalk નામક લોકેશન ટ્રેકિંગ સીસ્ટમ છે, જેના કારણે તે દેશમાં વહેંચાયેલા મેશ નેટવર્કને રોલઆઉટ કરવાની તૈયારી કરે છે. મૂળરૂપે સપ્ટેમ્બર 2019 માં જાહેર કરાયેલ, સાઈડવોક એ એમેઝોનના લાંબા-અંતરના વાયરલેસ નેટવર્ક બનાવવાના પ્રયત્નોનો એક ભાગ છે. જે ઈકો, રિંગ, ટાઈલ ટ્રેક્સ અને અન્ય સાઈડવોક સક્ષમ ડિવાઈસ પર વાતચીત કરવામાં સહાય માટે બ્લૂટૂથનો લાભ આપે છે.

સાઈડવોક લો-બેન્ડવિડ્થ ડિવાઈસની કાર્યકારી

શ્રેણીને વિસ્તૃત કરવા માટે બનાવવામાં આવ્યું છે અને ડિવાઈસને તેઓના ઘરના Wi-Fi નેટવર્કની મર્યાદાથી બહાર હોવા છતાં પણ કનેક્ટ રહેવામાં સહાય કરે છે. સાઈડવોક લો-રેન્જ વાયરલેસ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. જે ડિવાઈસની કાર્ય ક્ષમતા વધારે છે અને વધુ સમય સુધી ચાલુ રહે છે જેને LoRa તરીકે ઓળખવામાં આવે છે.

આ ઉપરાંત સાઈડવોક સેફ્ટી અને સિક્યુરીટી પણ આપે છે. જેથી આપણા ડેટા સુરક્ષિત રહી શકે. કંપનીએ વ્હાઈટ પેપરમાં જણાવ્યું હતું કે, સાઈડવોક નેટવર્કનું સંચાલન કરવા માટે સાઈડવોક એન્ડપોઈન્ટ્સથી મેટાડેટાની જરૂરિયાતને મર્યાદિત કરીને યુઝર્સની ગોપનીયતાનું રક્ષણ કરે છે. ખાનગી જાહેરનામાને રોકવા માટે સાઈડવોકને સુરક્ષા પ્રોટોકોલથી લાગુ કરવામાં આવ્યું છે. જે માહિતીની આપ-લે જે-તે નેટવર્ક પર જ પ્રસારિત કરશે.

વધુ ચિંતાની બાબત એ છે કે સાઈડવોક ઓપ્ટ-ઇન કરવાને બદલે ઓપ્ટ-આઉટ કરે છે એટલે કે યુઝર્સ જ્યાં સુધી સ્પષ્ટપણે તેને બંધ કરવાનું પસંદ ન કરે ત્યાં સુધી તે આપમેળે સાઈડવોકમાં પ્રવેશ કરશે. જે યુઝર્સ આ સુવિધાને ઓપ્ટ-આઉટ કરશે તે સાઈડવોકની કનેક્ટિવિટી અને સ્થાન સંબંધિત લાભ ને પણ ગુમાવશે.

@beinghumanmj

DIVINE YOGA

By Geeta

FREE Special Yoga Class Streaming NOW due to COVID

- Reduce Stress and Anxiety
- Boost Immunity and Sleep Quality
- Gain Strength and Flexibility
- Become the Best Version of Yourself

The beauty of yoga is that you don't have to be a yogi or yogini to reap the benefits

.....

Join today on ZOOM!

Classes Available: One-to-One Individual, Therapeutic, and Children

GEETA TAILOR : 416-456-2261

Contact Geeta at divineyogabygeeta@gmail.com
IG & FB: @divineyogabygeeta

LIFE INSURANCE

MORTGAGE/LINE OF CREDIT INSURANCE

Q : DO YOU HAVE MORTGAGE / LINE OF CREDIT INSURANCE WITH BANK ?
A : COMPARE & SAVE UP TO 50% LOWEST RATES GUARANTEED

AGE	\$ 250,000		\$ 500,000		\$ 1000,000	
	Male & Female	Male & Female	Male & Female	Male & Female	Male & Female	Male & Female
30 Yrs	\$ 12.00	\$ 07.00	\$ 18.00	\$ 10.00	\$ 32.00	\$ 19.00
40 Yrs	\$ 13.00	\$ 08.00	\$ 22.00	\$ 14.00	\$ 36.00	\$ 26.00
50 Yrs	\$ 30.00	\$ 18.00	\$ 50.00	\$ 31.00	\$ 95.00	\$ 60.00
60 Yrs	\$ 85.00	\$ 56.00	\$ 146.00	\$ 103.00	\$ 271.00	\$ 190.00

ALSO AVAILABLE

- ★ NO MEDICAL TEST LIFE INSURANCE (up to age 85)
(Even if you have DIABETES, BLOOD PRESSURE, HEART ATTACK, STROKE)
CANCER OR INSURANCE declined by other companies
- ★ CORPORATION OWNED LIF / CRITICAL ILLNESS INSURANCE
(Key Person INSURANCE, BUY SELL AGREEMENT, GROUP BENEFITS)
- ★ MONEY BACK LIFE / CRITICAL ILLNESS INSURANCE, RRSP, RESP, TFSA

Visitor To CANADA INS, TRAVEL INS, Lite ins For Refugees & Work Permits
Email : - Davindersinghfh@gmail.com
www.financialhuttd.com

Davinder Singh Chawla

416.320.4614 Toll : 1866.623.0865 Call For HONEST ADVICE

SUPER VISA INSURANCE

MONTHLY & ANNUAL PLANS
HARD TO BEAT OUR PREMIUMS

WTC-2021 ફાઇનલમાં ભાગ લેવા ઈંગ્લેન્ડ પહોંચી ભારતીય ટીમ



WTC પહેલાં શાસ્ત્રી અને કોહલી વચ્ચેની વાતચીતનો ઓડિયો લીક થયો

લંડન : ભારતીય ક્રિકેટ ટીમ ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમવા માટે લંડન પહોંચી ગઈ છે. ટીમ ઈન્ડિયાએ આ પ્રવાસ દરમિયાન ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝ પણ રમવાની છે. મહિલા અને પુરુષ ટીમ સાથે જ એક જ ફ્લાઈટમાં લંડન પહોંચી છે. વિરાટ કોહલી પોતાની પત્ની અનુષ્કા અને દિકરી વામિકા સાથે

એરપોર્ટમાંથી બહાર આવી રહ્યો હતો ત્યારે કેટલાક ફોટોગ્રાફર્સ વામિકાની તસવીર ખેંચવા પડાપડી કરી હતી. જેથી મામલો તંગ બની ગયો હતો. કોહલીએ આ મુદ્દે નાજરાગી વ્યક્ત કરી હતી. આ લાંબા પ્રવાસમાં ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ તથા યજમાન ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટની શ્રેણી રમવાની છે.

ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે પાંચ ટેસ્ટ મેચની શ્રેણી 4 ઓગસ્ટથી શરૂ થશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ 23 જૂન સુધી ચાલશે. એટલે કે ટીમ 41 દિવસ બાદ ટેસ્ટ રમવા જશે. 12 ઓગસ્ટથી બીજી ટેસ્ટ, 25 ઓગસ્ટથી ત્રીજી ટેસ્ટ, 2 સપ્ટેમ્બરથી ચોથી ટેસ્ટ અને 10 સપ્ટેમ્બરથી પાંચમી અને અંતિમ ટેસ્ટ 10 સપ્ટેમ્બરે થશે.



નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમ લગભગ ચાર મહિનાના લાંબા પ્રવાસ માટે લંડન પહોંચી ગઈ છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ઈંગ્લેન્ડ જવા રવાના થતાં અગાઉ હેડ કોચ રવિ શાસ્ત્રી સાથે પ્રેસ કોન્ફરન્સમાં ભાગ લીધો. બન્નેએ ભારતપૂર્વક જણાવ્યું હતું કે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મહત્વપૂર્ણ છે. જો કે આ દરમિયાન સોશિયલ મીડિયામાં શાસ્ત્રી-કોહલીનો એક ઓડિયો વાઈરલ થઈ રહ્યો છે. દાવો કરવામાં આવે છે કે કોચ અને કેપ્ટન વચ્ચેની વાતચીત પ્રેસ કોન્ફરન્સ અગાઉની છે. જો કે કોઈ માધ્યમ આ ઓડિયોને સત્તાવાર સમર્થન કરતું નથી. આ ઓડિયોમાં શાસ્ત્રી ટેસ્ટ મેચના સંદર્ભમાં બોલ્ટ અને વેગનરનો ઉલ્લેખ કરે છે. કોહલી કહે છે કે આપણે તેમને રાઉન્ડ ધી વિકેટ નાખીશું, તેમનામાં લેફ્ટ હેન્ડર્સ છે, લાલા અને સિરાજને શરૂઆતથી જ લગાવી દઈશું. નોંધનીય છે કે ન્યૂઝીલેન્ડના ટોચના પાંચ ખેલાડીમાં ત્રણ ખેલાડી-ડેવોન કોનવે, ટોમ લેથમ અને હેન્રી નિકોલ્સ ડાબા હાથના બેટ્સમેન છે. ૨૯ વર્ષના કોનવેએ એક દિવસ અગાઉ જ પોતાની ડેબ્યૂ ટેસ્ટમાં લોડ્ઝના મેદાન પર શાનદાર સદી ફટકારી છે.

વિમેન્સ ટીમ ૪૨ દિવસમાં ૧૦ દિવસ મેચ રમશે

ભારતની વિમેન્સ ટીમે ઈંગ્લેન્ડમાં એક ટેસ્ટ, ત્રણ વન-ડે તથા ત્રણ ટી૨૦ મેચ રમવાની છે. છેલ્લી મેચ ૧૪મી જુલાઈએ પૂરી થશે. વિમેન્સ ટીમ ૪૨ દિવસ ઈંગ્લેન્ડમાં રહેશે અને ૧૦ દિવસ મેચ રમશે. વિમેન્સ ટીમની ટેસ્ટ મેચ ચાર દિવસની રહેશે. ભારતીય ટીમ ૩૨ દિવસ ઓસ્ટ્રેલિયા દૂર રહેશે. બેકે આ ગાળામાં પ્રેક્ટિસ પણ ચાલુ રાખી શકે છે. ભારતીય ટીમને સાત વર્ષના લાંબા ગાળા બાદ પ્રથમ વખત ટેસ્ટ મેચ રમવા મળશે. મિતાલી રાજ ટેસ્ટ અને વન-ડેની તથા હરમનપ્રીત કૌર ટી૨૦ ટીમની સુકાની છે. ૨૦૨૨માં ન્યૂઝીલેન્ડ ખાતે રમાનારા વન-ડે વર્લ્ડ કપ માટે આ પ્રવાસ ઘણો મહત્વપૂર્ણ છે. કેટલાક સમય પહેલાં ઘરઆંગણે સાઉથ આફ્રિકા સામે રમાયેલી શ્રેણીમાં પરાજય થયો હોવાના કારણે આ પ્રવાસ મહત્વનો રહેશે.

WTC ફાઇનલ બેસ્ટ ઓફ-થી હોવી જોઈએ, એક મેચથી નિર્ણય ના થવો જોઈએ : શાસ્ત્રી

મુંબઈ: ન્યૂઝીલેન્ડ સામેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ તથા તે પછી ઈંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટ મેચની શ્રેણી માટે લંડન રવાના થતા પહેલાં ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે આટલી મોટી ટૂર્નામેન્ટના વિજેતાનો નિર્ણય એક જ ફાઇનલથી થવો જોઈએ નહીં. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ બેસ્ટ ઓફ-થી મુજબ રમાવી જોઈએ. નોંધનીય છે કે બેસ્ટ ઓફ-થી ફાઇનલમાં બે મેચ જીતનાર ટીમ વિજેતા જાહેર થતી હોય છે. ભારતના હેડ કોચ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ ત્રણ મેચોની હોવી જોઈએ. માત્ર એક જ મેચથી વિજેતાનો નિર્ણય લેવો યોગ્ય નથી. અમે એક મેચ માટે પણ તૈયાર છીએ.



ગંભીરે કોરોનાની ફેબિફલ દવાની કાળાબજરી કરી



નવીદિલ્હી: દિલ્હી સરકારના ડ્રગ કન્ટ્રોલરે ગુરુવારે હાઈકોર્ટમાં જણાવ્યું કે, ગૌતમ ગંભીરે ફાઉન્ડેશનને કોરોના દર્દીઓની સારવારમાં વપરાતી ફેબિફલ દવાની ગેરકાનૂની રીતે જમાખોરી, ખરીદવી અને તેના વિતરણનો દોષી સાબિત થયો છે. ડ્રગ કન્ટ્રોલરે કહ્યું કે, ફાઉન્ડેશન અને દવા ડીલરોની સામે કોઈપણ વિલંબ વગર કાર્યવાહી કરવામાં આવે. ધારાસભ્ય પ્રવિણ કુમારને પણ ડાઆવા જ ગુનાઓમાં દોષી ઠેરવવામાં આવ્યા છે.

ક્રિકેટરસીયાઓને ICCની મોટી ભેટ 8 વર્ષમાં 10 વર્લ્ડ કપ યોજવા નિર્ણય

નવીદિલ્હી મંગળવારે ICCની બેઠકમાં અનેક મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા. જ્યારે ICCએ આગામી 8 વર્ષ માટે ફ્યુચર ટૂર્સ પ્રોગ્રામ (FTP) તૈયાર કર્યો છે, આ વર્ષ ભારતમાં યોજાનારા ટી 20 વર્લ્ડ કપ માટે BCCIને થોડી રાહત પણ આપી હતી. આ મીટિંગમાં આઈસીસીએ આવા ઘણા નિર્ણયો લીધા જે ક્રિકેટ ચાહકો માટે ખુબ સારા સમાચાર જેવા છે. આઈસીસીએ તેના આગામી ટી૨૦ વર્લ્ડ કપના આયોજન માટે BCCIને 28મી જૂન સુધીનો સમય આપ્યો છે. આઈસીસીએ સંકેત આપી દીધો છે કે કોરોના વાઈરસની મહામારીની વચ્ચે પોતે ક્રિકેટની મેગા ઇવેન્ટનું આયોજન કરી શકશે કે નહીં તે અંગે BCCIને અલ્ટિમેટમ આપી દીધું છે. આઈસીસીની બેઠકમાં બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહ હાજરી આપી હતી. BCCIએ વર્લ્ડ કપના આયોજન અંગે અંતિમ નિર્ણય લેવા માટે એક મહિનાનો સમય માગ્યો હતો. આઈસીસીના એક અધિકારીએ જણાવ્યું હતું કે ક્રિકેટની વિશ્વ સંચાલક સંસ્થાએ બીસીસીઆઈની વિનંતીને માન્ય રાખી છે અને તેને 28મી જૂન સુધીમાં અંતિમ નિર્ણય લેવાની તાકીદ કરી છે. આઈસીસીના ફ્યુચર ટૂર્સ પ્રોગ્રામ મુજબ, 2024 થી 2031 દરમિયાન 4 ટી 20 વર્લ્ડ કપ યોજાશે જેમાં 20 ટીમો ભાગ લેશે. આ ઉપરાંત 2 વન-ડે વર્લ્ડ કપનું પણ આયોજન કરવામાં આવશે જેમાં કુલ 14 ટીમોનો સમાવેશ કરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન 2 ચેમ્પિયન્સ ટ્રોફી અને 4 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ્સ પણ ICCએ નિર્ણય લીધો છે કે 2024-31 દરમિયાન યોજાનારા ટી 20 વર્લ્ડ કપમાં કુલ 55 મેચ યોજાશે, જ્યારે વન-ડે વર્લ્ડ કપમાં 54 મેચ યોજાશે.



રેકોર્ડ રજમા ગ્રાન્ડસ્લેમ તરફ સેરેનાની આગેકૂચ



પેરિસ: પોતાના રેકોર્ડ રજમા ગ્રાન્ડ સ્લેમ જીતવાનો પ્રયાસ કરી રહેલી સેરેના વિલિયમ્સે કેન્ચ ઓપનના ત્રીજા રાઉન્ડમાં પોતાની જગા બનાવી લીધી છે. વિશ્વની આઠમા ક્રમની ખેલાડી સેરેનાએ બુધવારે રાત્રે મહિલા સિંગલ્સના બીજા રાઉન્ડમાં વિશ્વની નંબર ૧૪૮ અને રોમાનિયાની વતની મિહાઇલા બુઝારનેસ્કૂને ૬-૩, ૫-૭, ૬-૧થી પરાજિત કરી હતી. બીજી તરફ વિશ્વની નંબર ૩૫ પોલા બડોસાએ મોંટેનેગરોની ડેન્કા કોવિનિચને ૬-૨, ૬-૦થી પરાજિત કરી છે.



ડેબ્યુ મેચમાં જ આ ક્રિકી બેટ્સમેને ફટકારી ૩બલ સેન્યુરી

200 રન ફટકારી 125 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાંખ્યો

લોડ્સ ક્રિકેટનું મક્કા ગણાતા લોડ્સ મેદાન પર ન્યૂઝીલેન્ડના બેટ્સમેન ડેવિડ મિલરે ઈતિહાસ રચ્યો છે. ટેસ્ટ મેચમાં ડેબ્યૂ કરનાર ડેવિડ કોનવે ઈંગ્લેન્ડમાં ડેબ્યૂ મેચમાં સૌથી વધારે રન બનાવનાર દુનિયાનો પહેલો ખેલાડી બની ગયો છે. તેણે ગુરુવારે કેએસ રણજીતસિંહજીનો રેકોર્ડ તોડ્યો છે. તેઓએ વર્ષ 1896માં ઓસ્ટ્રેલિયાની સામે પોતાની ડેબ્યુ મેચમાં 154 રન બનાવ્યા હતા. ડેવિડ કોનવેએ અગાઉ ટેસ્ટ મેચના પહેલા દિવસે ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીનો 25 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો. ગાંગુલીએ 1996માં લોડ્સ ખાતેની તેની ડેબ્યૂ ટેસ્ટમાં 131 રન બનાવ્યા હતા. કોનવે આ મેદાન પર તેની ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારનાર ગાંગુલી પછીનો પહેલો જ મુલાકાતી બેટ્સમેન છે. ડેબ્યૂ ટેસ્ટમાં 150 રન બનાવનારો તે ન્યૂઝીલેન્ડનો ત્રીજો ખેલાડી બન્યો છે.

ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારત ૧૯૦ સભ્યોની ટીમ મોકલશે

નવી દિલ્હી ટોક્યો ઓલિમ્પિક્સ શરૂ થવાના હવે દિવસો ગણાઈ રહ્યા છે ત્યારે ભારત તરફથી ૧૦૦થી વધારે એથલેટ્સ સાથે આશરે ૧૯૦ સભ્યોની મજબૂત ટુકડી ટોક્યો મોકલવામાં આવે તેવી શક્યતા છે, તેમ ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના પ્રેસિડેન્ટ નરિન્દર બત્રાએ ગુરુવારે જણાવ્યું હતું. કેન્દ્રીય રમતગમત મંત્રી કિરણ રિજિજુ દ્વારા ઓલિમ્પિકમાં ભાગ લેનારા દેશના ખેલાડીઓ માટે ઓફિશિયલ કિટ ખુલ્લી મૂકી તે પ્રસંગે બત્રાએ ઉપરોક્ત અપેક્ષા વ્યક્ત કરી હતી. નોંધનીય છે કે અત્યાર સુધીમાં ૧૦૦ એથલેટ્સ ટોક્યો ગેમ્સ માટે ક્વોલિફાઈ થઈ ગયા છે જેમાં ૫૬ પુરુષો છે અને ૪૪ મહિલાઓનો સમાવેશ થાય છે. IOA અપેક્ષા રાખે છે કે હજુ ૨૫થી ૩૫ ભારતીય ખેલાડીઓને એન્ટ્રી થઈ શકે છે જેની શરૂઆત ૨૩ જુલાઈના રોજ થશે. ટોક્યો ગેમ્સ માટે ૫૦ દિવસ બાકી રહ્યા છે તેની ઉજવણી સાથેના આ ઓનલાઈન સમારોહ દરમિયાન બત્રાએ જણાવ્યું હતું કે આગામી બેથી ત્રણ સપ્તાહ દરમિયાન ક્વોલિફિકેશનની પ્રક્રિયા ખતમ થશે ત્યાં સુધીમાં દેશના ક્વોલિફાઈ એથલેટ્સની સંખ્યા ૧૨૫-૧૩૫ થઈ જશે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.

Dr. Salim Kapadia DDS

Dental Centre

Your Perfect
Smile...Is Our Greatest
Satisfaction!**SERVICES**

- Smile Makeover
- Laser Teeth Whitening
- Dental Implants - Start to Finish
- Single Visit Root Canal
- Re-treatment of Failing Root Canal
- Surgical Wisdom Teeth Extraction
- Scaling & Root Planing
- White Tooth Colored Filling
- Implant Retained Dentures
- Complete & Partial Dentures
- Lumineers & Veneers
- Crown & Bridges (Zirconia & E.max)

1825 Markham Rd, Suite 102
Scarborough, ON M1B 4Z9
drsalimkapadiadental.com

416-321-3268

**Chapel
Ridge**
FUNERAL HOME
& CREMATION CENTRE

416.993.0826
24/7 # 905.305.8508



તમારી સગવડ માટે અમે બે ફ્યુનરલ સેન્ટર ઓફર કરીએ છીએ. મારખમ અને મિસિસાગા. સંપૂર્ણ હિન્દુ તથા જૈન વિધિની સગવડતા. (St. John's Dixie, 737 Dundas St. E., Mississauga, ON L4Y 2B5)

ફ્યુનરલ સર્વિસ, બેઝિક કાસ્કેટ, ક્રિમેશન અને ટેક્સ બધાં સાથે ટોટલ ફક્ત \$4270

વધુ માહિતી માટે ફોન કરો. અમારો પ્રોફેશનલ સ્ટાફ તમારી ભાષામાં તમને માહિતી આપશે.
પ્રિપેઇડ ફ્યુનરલ અને ટ્રાવેલ ઈન્સુરન્સ

1. તમારા ડોલર ફ્યુનરલ હોમમાં જમા નહિ થાય. પરંતુ સરકારે નીમેલી ટ્રસ્ટ કંપની પાસે રહેશે.
2. એક વખત પ્લાન ખરીદ્યા પછી તમે કે તમારા ફેમિલીએ કદીપણ વધુ પૈસા નહિ આપવા પડે.
3. ટ્રાવેલ ઈન્સુરન્સ - ફક્ત **\$595** એક વખત આપી જિંદગી ભર તમે ક્યાંય પણ નિશ્ચિત ટ્રાવેલ કરી શકશો. *

* This is not a general insurance. Applies only in case of a death away from home.

8911 Woodbine Avenue, Markham, Ontario L3R 5G1
www.chapelridgefh.com • info@chapelridgefh.com